

PROVISIONAL ANSWER KEY

NAME OF THE POST

Assistant Professor Accountancy, Class II, Advt No. 82/2016-17(ACG)

Preliminary Test on 02-04-2017

Subject Que : 101-300

Publish Date : 04-04-2017

Last Date to send suggestion(s) :11-04-2017

Note: Candidate must ensure the compliance to send all suggestion in the given format with reference to this paper with provisional answer key only.

101. હિસાબી પધ્ધતિ સમીકરણ ..... આધારિત છે.  
 (A) સાતત્યનો ખ્યાલ (B) બેવડાં પાસાનો ખ્યાલ  
 (C) નાણા માપણીનો ખ્યાલ (D) ઉપરનાં બધાજ
102. હિસાબી પધ્ધતિ એ .....  
 (A) ધંધાનું મુખ્ય કાર્ય છે. (B) ધંધાનું નકામું કાર્ય છે.  
 (C) ધંધાનું સહાયક કાર્ય છે. (D) ધંધાનું સામાન્ય કાર્ય છે.
103. ઘાલખાધની જોગવાઈ ..... ના સિધ્ધાંતને આધારે કરવામાં આવે છે.  
 (A) રૂઢિચુસ્તતા (B) આવક મેળવણી  
 (C) પૂર્ણ પ્રાગટીકરણ (D) (A) અને (B) બંને
104. હિસાબી પધ્ધતિ એ એવી માહિતી પધ્ધતિ છે કે જે કાચી માહિતીને અર્થપૂર્ણ માહિતીમાં પરિવર્તિત કરે છે. આ વિધાન માટે કયો વિકલ્પ સાચો છે ?  
 (A) આ વિધાન સાચું છે. (B) આ વિધાન ખોટું છે.  
 (C) (A) અને (B) બંને લાગુ પડે છે. (D) ઉપરનું કોઈ નહીં
105. માનવ સંસાધન હિસાબી પધ્ધતિમાં, 'સમાયોજિત ડિસ્કાઉન્ટેડ ભાવી વેતન મોડેલ' કોણે વિકસાવેલું છે ?  
 (A) રોજર એચ. હર્મ્સન (B) વાયને જે. મોર્સ  
 (C) પેકીન ઓર્ગન (D) આર. જી. બેરી
106. અસ્તિત્વનો ખ્યાલ હિસાબનીશને ..... વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરાવે છે.  
 (A) વ્યક્તિગત અને ધંધાકીય વ્યવહાર  
 (B) વ્યક્તિગત અને બિનધંધાકીય વ્યવહાર  
 (C) (A) અને (B) બંને  
 (D) ઉપરનાં કોઈ નહીં
107. હિસાબી સિધ્ધાંતો સામાન્ય રીતે ..... આધારીત હોય છે.  
 (A) વ્યવહારુતા (B) વિષયવસ્તુ  
 (C) સાદગીપણું (D) નોંધણીમાં સરળતા
108. માનવ સંસાધન પધ્ધતિમાં નીચેના પૈકી કયો પડતર અભિગમ નથી ?  
 (A) ઐતિહાસિક પડતર પધ્ધતિ (B) વૈકલ્પિક પડતર પધ્ધતિ  
 (C) પુનઃસ્થાપના પડતર પધ્ધતિ (D) ઉપરનાં કોઈ નહીં
109. વસૂલાતના ખ્યાલ પ્રમાણે આવક ક્યારે સ્વીકૃત ગણાય છે ?  
 (A) રોકડ વસૂલ થાય ત્યારે (B) આયોજન થાય ત્યારે  
 (C) વેચાણ થાય ત્યારે (D) વસ્તુ ઉત્પાદિત થાય ત્યારે

101. The Accounting Equation is based on \_\_\_\_\_.  
(A) going concern concept (B) dual aspect concept  
(C) money measurement concept (D) All of the above
102. Accounting is a \_\_\_\_\_.  
(A) prime function of business (B) useless function of business  
(C) support function of business (D) ordinary function of business
103. Provision for bad debts is made on the basis of the principle of \_\_\_\_\_.  
(A) conservatism (B) revenue matching  
(C) full disclosure (D) both (A) and (B)
104. Accounting is an information system which converts the raw data into meaningful information. Which option is correct in view of this statement?  
(A) It is true (B) It is false  
(C) Both (A) and (B) apply (D) None of the above apply
105. Who developed the 'Adjusted Discounted Future Wages Model' in Human Resource Accounting?  
(A) Roger H Hermanson (B) Wayne J. Morse  
(C) Pekin Ogan (D) R. G. Barry
106. Entity concept enable the accountants to distinguish between \_\_\_\_\_.  
(A) personal and business transactions  
(B) personal and non-business transactions  
(C) Both A and B  
(D) None of the above
107. Accounting principles are generally based on \_\_\_\_\_.  
(A) practicability (B) subjectivity  
(C) simplicity (D) convenience in recording
108. Which of the following is not a Cost Approach to the Human Resource Accounting ?  
(A) Historical Cost Method (B) Opportunity Cost Method  
(C) Replacement Cost Method (D) None of the above
109. According to realization concept, revenue is recognized when \_\_\_\_\_.  
(A) the cash is collected (B) the planning take place  
(C) the sale is made (D) the products are manufactured

110. મજૂરીને સંપત્તિના પિતા તરીકે કોણે લક્ષમાં લીધી ?
- (A) રોજર એચ. હર્મ્સન (B) સર વિલિયમ પેટી  
(C) વાયને જે. મોર્સ (D) પેકીન ઓર્ગન
111. 'નફાની કોઈ અપેક્ષા નહીં અને બધા શક્ય નુકશાનની જોગવાઈ કરવી' આ વિધાન કયા સિધ્ધાંતના આધારે ઘણી વખત વર્ણવામાં આવે છે ?
- (A) એકરૂપતાનો સિધ્ધાંત (B) સંચયનો સિધ્ધાંત  
(C) રૂઢિચુસ્તતાનો સિધ્ધાંત (D) સાતત્યનો સિધ્ધાંત
112. સામાન્ય સ્વીકૃત હિસાબી સિધ્ધાંત (GAAP) એ ટેકનિકલ હિસાબી પદમાં ..... સમાવેશ થાય છે.
- (A) પરંપરાગત સિધ્ધાંતો (B) નિયમો  
(C) પ્રક્રિયા (D) (A), (B) અને (C) ઉપરનાં બધા જ
113. પુન : વેચાણ માટે માલની ખરીદ પડતર એ ..... નું ઉદાહરણ છે.
- (A) મુલત્વી રાખેલ મહેસૂલી ખર્ચ (B) આવક ખર્ચ  
(C) મૂડી ખર્ચ (D) મૂડી રસીદ
114. .... એ પ્રાથમિક ખર્ચાનું ઉદાહરણ છે.
- (A) આવક ખર્ચ (B) મૂડી ખર્ચ  
(C) મુલત્વી રાખેલ મહેસૂલી ખર્ચ (D) મૂડી આવક ખર્ચ
115. મૂડી આવક એ ..... પદનો પર્યાય છે.
- (A) મૂડી લાભ (B) મૂડી નુકશાન  
(C) મહેસૂલી લાભ (D) મહેસૂલી ખર્ચ
116. કુગાવાના સમય દરમ્યાન, સામાન્ય રીતે, નફાની રકમ ..... છે.
- (A) બિન અસરકારક રહે (B) વધારે બતાવે  
(C) ઓછું બતાવે (D) ઉપરનાં કોઈ નહીં
117. પેટન્ટ રાઈટ્સની ખરીદી એ ..... ગણાય.
- (A) મુલત્વી રાખેલ ખર્ચ (B) મહેસૂલી ખર્ચ  
(C) ધંધાકીય ખર્ચ (D) મૂડી ખર્ચ
118. પેઢી તેના યંત્રોનું વેચાણ કરે એ ..... ગણાય.
- (A) ધંધાકીય રસીદ (B) મહેસૂલી રસીદ  
(C) મૂડી રસીદ (D) ઉપરનાં કોઈ નહીં

110. Who considered labour as the Father of Wealth ?  
(A) Roger H Hermanson (B) Sir William Petty  
(C) Wayne J Morse (D) Pekin Ogan
111. Which principle is often described as “anticipate no profits and provide for all possible losses”?  
(A) Matching principle (B) Accrual principle  
(C) Conservatism principle (D) Consistency principle
112. Generally Accepted Accounting Principle (GAAP) is a technical accounting term that encompasses \_\_\_\_\_.  
(A) the conventions (B) the rules  
(C) the procedure (D) All (A),(B) and (C) above
113. Cost of goods purchased for resale is an example of \_\_\_\_\_.  
(A) deferred revenue expenditure (B) revenue expenditure  
(C) capital expenditure (D) capital receipt
114. Preliminary expenses are an example of \_\_\_\_\_.  
(A) revenue expenditure (B) capital expenditure  
(C) deferred revenue expenditure (D) capital income
115. Capital income is synonymous to the term \_\_\_\_\_.  
(A) capital gain (B) capital loss  
(C) revenue gain (D) revenue expenditure
116. During the periods of inflation, the amount of profit is normally \_\_\_\_\_.  
(A) unaffected (B) overstated  
(C) understated (D) None of the above
117. Purchase of patent rights is a \_\_\_\_\_.  
(A) deferred expenditure (B) revenue expenditure  
(C) business expenditure (D) capital expenditure
118. The selling of its own machinery by a firm is a \_\_\_\_\_.  
(A) business receipt (B) revenue receipt  
(C) capital receipt (D) None of the above

119. કુગાવાજન્ય હિસાબી પધ્ધતિમાં ખરીદ શક્તિ લાભ ..... ને કારણે ઉદભવે છે.  
 (A) નાણાકીય મિલકતો (B) નાણાકીય જવાબદારીઓ  
 (C) નાણાકીય બાબતો (D) ઉપરનાં બધાજ
120. મહેસૂલી નુકશાન પદનું સમાન પદ ..... છે.  
 (A) મહેસૂલી ખર્ચ (B) મહેસૂલી આવક  
 (C) મહેસૂલી રસીદ (D) મુલત્વી રાખેલ નુકશાન
121. નીચેના પૈકી કયો હવાલો વર્તમાન પડતર હિસાબી પધ્ધતિ હેઠળ આવતો નથી ?  
 (A) વેચાણ પડતર હવાલો (B) ઘસારા નો હવાલો  
 (C) ગિયરિંગ હવાલો (D) ખરીદ શક્તિ લાભ
122. .... 'પ્રવેશ મૂલ્ય અભિગમ' કુગાવાજન્ય હિસાબી પધ્ધતિમાં આવે છે ?  
 (A) વર્તમાન ખરીદ શક્તિ (B) વર્તમાન પડતર હિસાબી પધ્ધતિ  
 (C) (A) અને (B) બંને (D) ઉપરનાં કોઈ નહીં
123. નાણાકીય કાર્યશીલ મૂડી હવાલામાં ..... લક્ષમાં લેવાશે નહીં.  
 (A) દેવાદારો (B) રોકડ  
 (C) લેણદારો (D) ઉપરનાં કોઈ નહીં
124. વ્યવહારો હમેશાં ..... સાથે હોય છે.  
 (A) આંતરીક પક્ષકારો (B) સંચાલક મંડળ  
 (C) બાહ્ય પક્ષકારો (D) ઉપરનાં કોઈ નહીં
125. ઘટના ફક્ત નીચેની પરિસ્થિતીમાં ધ્યાનમાં લેવામાં આવે છે.  
 (A) હિસાબી વર્ષના પ્રથમ દિવસે  
 (B) હિસાબી વર્ષના આખરી દિવસે  
 (C) હિસાબી વર્ષ દરમ્યાન  
 (D) (A) અને (B) બંને
126. .... એ પેઠીની સામાજિક જવાબદારીનો ભાગ ગણાય છે.  
 (A) ચોખ્ખી આવક ફાળો (B) જાહેર ફાળો  
 (C) પર્યાવરણ ફાળો (D) ઉપરનાં બધા જ
127. નફા-નુકશાન ખાતું-પાર્ટ II ..... દર્શાવે છે.  
 (A) કાચો નફો અથવા નુકશાન (B) ચોખ્ખો નફો અથવા નુકશાન  
 (C) વેચેલ માલની પડતર (D) વેચાણ અને આખર સ્ટોક

119. In Inflation Accounting, the purchasing power Gain arises because of \_\_\_\_\_.  
(A) monetary Assets (B) monetary liabilities  
(C) monetary items (D) All of the above
120. The term 'Revenue Loss' is similar to the term \_\_\_\_\_.  
(A) revenue expenditure (B) revenue income  
(C) revenue receipt (D) deferred loss
121. Which of the following is not an Adjustment under Current Cost Accounting Method?  
(A) Cost of sales Adjustment (B) Depreciation Adjustment  
(C) Gearing Adjustment (D) Purchasing Power Gain
122. Which of the following is an entry Value Approach to Inflation Accounting?  
(A) Current Purchasing Power (B) Current Cost Accounting  
(C) Both A and B (D) None of the above
123. The following is not considered in Monetary Working Capital Adjustment.  
(A) Debtors (B) Cash  
(C) Creditors (D) None of the above
124. Transactions are always with \_\_\_\_\_.  
(A) Internal parties (B) Management  
(C) External parties (D) None of the above
125. Events are considered only \_\_\_\_\_.  
(A) on the first day of the accounting year  
(B) on the last day of the accounting year  
(C) during the accounting year  
(D) Both A and B
126. \_\_\_\_\_ is the part of social responsibility of a firm.  
(A) Net Income Contribution (B) Public Contribution  
(C) Environment Contribution (D) All of the above
127. Profit and Loss account part II discloses \_\_\_\_\_.  
(A) the gross profits or losses (B) the net profits or losses  
(C) Cost of goods sold (D) Sales and closing stock

128. કંપનીના સામાજિક ફાળાને 'મિલકત' તરીકે ગણવાના મોડેલને કઈ કંપનીએ વિકસાવ્યું ?
- (A) ઈન્ટરનેશનલ બિઝનેસ મશીન (B) સ્કોવિલ મેન્યુફેક્ચરિંગ કંપની  
(C) એબીટી એસોસિએટ્સ ઈનકોર્પોરેશન (D) ઈમ્પિરિકલ કેમિકલ ઈન્ડસ્ટ્રી
129. .... હિસાબી ધોરણો રેવન્યુને લાગુ પડે છે.
- (A) AS-18 અને IAS-18 (B) AS-18 અને IAS-9  
(C) (A) અને (B) બંને (D) ઉપરનાં કોઈ નહીં
130. .... એ પર્યાવરણ હિસાબી પદ્ધતિનો ભાગ નથી.
- (A) ગ્રીન હિસાબી પદ્ધતિ (B) સામાજિક હિસાબી પદ્ધતિ  
(C) (A) અને (B) બંને (D) પરંપરાગત હિસાબી પદ્ધતિ
131. પર્યાવરણ હિસાબી પદ્ધતિના કાર્યક્ષેત્રમાં ..... નો સમાવેશ થતો નથી.
- (A) રાષ્ટ્રીય આવક (B) કુગાવો  
(C) સામાજિક સુખાકારી (D) કુદરતી સ્ત્રોત
132. ભાગીદારોમાં નફો અને નુકશાન, ભાગીદારી કરારમાં કોઈપણ જોગવાઈના અભાવે ..... વહેંચાય છે.
- (A) સરખાભાગે (B) તેમની મૂડીના પ્રમાણમાં  
(C) તેઓએ આપેલી રોકડના પ્રમાણમાં (D) તેઓએ આપેલી લોનના પ્રમાણમાં
133. નવા ભાગીદારના પ્રવેશ સમયે , સામાન્ય અનામતની ફેરબદલી ..... થાય છે.
- (A) ભાગીદારોના લોન ખાતે (B) નફા-નુકશાન હવાલા ખાતે  
(C) ભાગીદારોના મૂડી ખાતે (D) ઉપરનાં કોઈ નહીં
134. નીચેનો ફાયદો કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિનો છે.
- (A) ચોકસાઈ (B) ઝડપ  
(C) સાતત્ય (D) ઉપરનાં બધા જ
135. P અને Q 3:2 ના પ્રમાણમાં નફો વહેંચે છે. તેઓ R નો પ્રવેશ નફામાં 1/5 ભાગથી કરે છે જે તે P અને Q પાસેથી સરખાભાગે મેળવે છે. તો હવે ભાગીદારો વચ્ચે નવા નફા વહેંચણીનું પ્રમાણ ..... રહેશે.
- (A) 12 : 8 : 5 (B) 5 : 3 : 2  
(C) 2 : 2 : 1 (D) 8 : 12 : 5

128. Which company first developed the model in which the social contribution made by the company is treated as assets?
- (A) International Business Machine      (B) Scovil manufacturing company  
**(C) ABT Associates Intercorporation**      (D) Imperial Chemical Industries
129. Which of the following Accounting standards are applicable to revenue?
- (A) AS – 18 and IAS - 18**      (B) AS – 18 and IAS - 9  
 (C) Both A and B      (D) None of the above
130. Environment accounting is not the part of \_\_\_\_ .
- (A) Green Accounting      (B) Social Accounting  
 (C) Both A and B      **(D) Traditional Accounting**
131. \_\_\_\_ is not included in the scope of environment Accounting.
- (A) National Income      **(B) Inflation**  
 (C) Social Wellbeing      (D) Natural Resources
132. In the absence of any provision in the partnership agreements, profits and losses are shared by partners \_\_\_\_.
- (A) equally**      (B) in the ratio of their capital  
 (C) in the ratio of cash given by them      (D) in the ratio of loan given by them
133. At the time of admission of a new partner, general reserve is transferred to \_\_\_\_.
- (A) partners loan account      (B) profit and loss adjustment account  
**(C) partners capital account**      (D) None of the above
134. The following is the benefit of computer accounting
- (A) Accuracy      (B) Speed  
 (C) Consistency      **(D) All of the above**
135. P and Q share profits in the ratio 3:2. They admit R with  $\frac{1}{5}$  shares in the profits which R gets equally from P and Q. The new profit sharing ratio between the partners will be \_\_\_\_ .
- (A) 12 : 8 : 5      **(B) 5 : 3 : 2**  
 (C) 2 : 2 : 1      (D) 8 : 12 : 5

136. P, Q અને R ભાગીદારો છે જે 2 : 2 : 1 ના પ્રમાણમાં નફો વહેંચે છે. R નિવૃત્ત થાય છે. હવે P અને Q વચ્ચે નવું નફા વહેંચણીનું પ્રમાણ ..... થશે.
- (A) 2 : 1 (B) 3 : 2  
(C) 1 : 1 (D) 1 : 2
137. કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિમાં ડિજિટ પદનો સંદર્ભ ..... સાથે છે.
- (A) આંકડાકીય ગુણધર્મ (B) ચોક્કસ ગુણધર્મ  
(C) વર્ણાનુક્રમ ગુણધર્મ (D) ઉપરનાં બધાજ
138. કોઈપણ કરારના વિરુદ્ધના અભાવમાં, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે, મૂડીનફો ભાગીદારોમાં ..... જમા થાય છે.
- (A) સરખાભાગે (B) મૂડીના પ્રમાણમાં  
(C) નફા વહેંચણીના પ્રમાણમાં (D) ઉપરનાં કોઈ નહીં
139. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે, સંશયિત દેવાની જોગવાઈની ફેરબદલી ..... કરવામાં આવે છે.
- (A) ભાગીદારોના મૂડી ખાતે (B) વસૂલાત ખાતે  
(C) પરચુરણ દેવાદારો ખાતે (D) નફા-નુકશાન ખાતે
140. 1024 મેગા બાઈટ એટલે .....
- (A) 1 ગીગા બાઈટ (B) 1 કિલો બાઈટ  
(C) 1 મેગા બાઈટ (D) ઉપરનાં કોઈ નહીં
141. કમાન્ડ એવો શબ્દ છે. જે સમગ્ર ..... ને સક્રિય કરે છે.
- (A) સોફ્ટવેર (B) બધાજ પ્રોગ્રામ્સ  
(C) સોફ્ટવેર અને બધાજ પ્રોગ્રામ્સ (D) ઉપરનાં કોઈ નહીં
142. રૂ. 8 લાખની ચોખ્ખી મિલકતોના સંદર્ભમાં, કંપની રૂ. 10 લાખના પૂર્ણ ભરપાઈ થયેલ શેર આપે તો બાકીના રૂ. 2 લાખ ..... ઉધારવામાં આવશે.
- (A) પાઘડી ખાતે  
(B) નફાનુકશાન ખાતે  
(C) નફાનુકશાન ફાળવણી ખાતે  
(D) મૂડી અનામત ખાતે
143. કોમ્પ્યુટર હાર્ડવેરના મૂળતત્વના માળખામાં ..... હોય છે.
- (A) માહિતી તૈયાર કરવામાં સામેલ ડિવાઈસિસ  
(B) મધ્યસ્થ પ્રક્રિયા એકમ  
(C) માહિતી મૂકવામાં સામેલ ડિવાઈસિસ  
(D) ઉપરનાં બધાજ

136. P, Q and R are partners sharing profits in the ratio of 2 : 2 : 1 R retires. Now the new profit sharing ratio between P and Q will be \_\_\_\_ .  
(A) 2 : 1 (B) 3 : 2  
(C) 1 : 1 (D) 1 : 2
137. In computer accounting, the term digit refers to a \_\_\_\_ .  
(A) Numeric character (B) Specific character  
(C) Alphabetic character (D) All of the above
138. In the absence of any contract to the contrary, capital profit on dissolution of a partnership firm, is credited to the partners \_\_\_\_ .  
(A) equally (B) in capital ratio  
(C) in profit sharing ratio (D) None of the above
139. In the event of dissolution of a partnership firm, the provision for doubtful debts is transferred to \_\_\_\_ .  
(A) Partners capital account (B) Realisation account  
(C) Sundry debtors account (D) Profit and loss account
140. 1024 Mega bytes means  
(A) 1 Gigabytes (B) 1 kilobytes  
(C) 1 Megabytes (D) None of the above
141. A Command is a single word that would activate the entire \_\_\_\_ .  
(A) software (B) all the programs  
(C) software and all the programs (D) None of the above
142. If a company has issued fully paid shares of Rs 10 lakh in consideration of net assets of Rs 8 lakh. The balance of Rs 2 lakh will be debited to \_\_\_\_ .  
(A) goodwill account  
(B) profit and loss account  
(C) profit and loss Appropriation account  
(D) capital reserve account
143. The elements in a computer hardware configuration are \_\_\_\_ .  
(A) devices involved in data preparation  
(B) the central processing unit  
(C) devices involved in input of data  
(D) All of the above

144. જો 100 રૂ. ના એક એવા શેર જેના પર 60 રૂ. ચૂકવેલ હોય તેવા શેર જપ્ત કરવામાં આવે તો ઓછામાં ઓછા કઈ કિંમતે ફરી બહાર પાડી શકાય ?
- (A) શેર દીઠ રૂ. 60 (B) શેર દીઠ રૂ. 100  
(C) શેર દીઠ રૂ. 160 (D) શેર દીઠ રૂ. 40
145. સેવા પડતર એ ..... પડતર વ્યાખ્યાયિત છે.
- (A) ઉત્પાદિત માલ (B) પેદાશ પૂરી પાડવી  
(C) સેવા પૂરી પાડવી (D) ઉપરનાં કોઈ નહીં
146. જાહેર મર્યાદિત કંપની ..... પાડી શકે નહીં.
- (A) ઇક્વિટી શેર (B) ડિફર્ડ શેર  
(C) પ્રેફરેન્સ શેર (D) બોનસ શેર
147. હોટેલમાં સામાન્ય રીતે ..... ની પડતર ગણવામાં આવે છે.
- (A) વેતન અને પગાર (B) ખોરાકની જોગવાઈઓ  
(C) ઇન્ટરનેટ અને વાઈ-ફાઈ સેવાઓ (D) ઉપરની બધી જ
148. પડતર અને નાણાકીય હિસાબી પદ્ધતિની મેળવણી ..... માં થાય છે.
- (A) બિન સંકલિત હિસાબી પદ્ધતિ (B) સંકલિત હિસાબી પદ્ધતિ  
(C) (A) અને (B) (D) ઉપરનાં કોઈ નહીં
149. હોસ્પિટલ પડતર હિસાબી પદ્ધતિમાં, પ્રત્યક્ષ પડતરમાં ..... ના ખર્ચાનો સમાવેશ થાય છે.
- (A) વોર્ડ (B) મેડિકલ સેવા વિભાગ  
(C) બહારના દર્દીનો વિભાગ (D) ઉપરનાં બધાજ
150. પડતર અને નાણાકીય હિસાબી પદ્ધતિની મેળવણી ખાતાના 2 સેટમાં ..... સુનિશ્ચિત કરે છે.
- (A) ચોકસાઈ (B) તરલતા  
(C) નફાકારકતા (D) ઉપરનાં કોઈ નહીં
151. કંપનીએ રૂ. 10 નો એક એવા 100 શેર, રૂ. 1 ના પ્રિમિયમ બહાર પાડેલા, તે જપ્ત કર્યા. શેર વહેંચણી વખતે પ્રિમિયમ ચૂકવવાનું હતું. શેર હોલ્ડર, શેર દીઠ રૂ. 3 (પ્રિમિયમ સહિત) વહેંચણીની રકમ અને શેર દીઠ રૂ. 2 હપ્તાની રકમ ચૂકવી શકેલ નથી. તો શેર જપ્તી ખાતે કેટલી રકમ જમા થશે ?
- (A) રૂ. 500 (B) રૂ. 600  
(C) રૂ. 700 (D) રૂ. 200

144. If a share of Rs 100, on which Rs 60 has been paid, is forfeited, it can be reissued at the minimum price of \_\_\_\_\_ .
- (A) Rs 60 per share (B) Rs 100 per share  
(C) Rs 160 per share (D) Rs 40 per share
145. The service cost is defined as the cost of \_\_\_\_\_ .
- (A) producing goods (B) providing product  
(C) providing a service (D) None of the above
146. A public limited company cannot issue the \_\_\_\_\_ .
- (A) Equity shares (B) Deferred shares  
(C) preference shares (D) bonus shares
147. Which of the following costs are generally incurred in a hotel?
- (A) wages and salaries (B) provisions of foods  
(C) internet and Wi-fi services (D) All of the above
148. Cost and financial accounting are reconciled under \_\_\_\_\_ .
- (A) non-integral accounting (B) integral accounting  
(C) Both A and B (D) None of the above
149. In hospital costing, direct cost includes the expenditure incurred on \_\_\_\_\_ .
- (A) the ward (B) the medical service department  
(C) the outpatient department (D) All of the above
150. Reconciliation of the cost and \_\_\_\_\_ financial accounts ensures in two sets of accounts.
- (A) accuracy (B) liquidity  
(C) profitability (D) None of the above
151. A company forfeits 100 shares of Rs. 10 each, issued at Re. 1 premium. The premium was payable on allotment. The shareholder failed to pay allotment money of Rs. 3 per share (including premium) and the call money of Rs. 2 per share. How much amount is credited to forfeited share account?
- (A) Rs. 500 (B) Rs. 600  
(C) Rs. 700 (D) Rs. 200

152. જો રૂ. 10 નો શેર રૂ. 1 ના વટાવે, મૂળ રીતે બહાર પડેલ જપ્ત થાય અને તેના પર મળેલ રકમ રૂ. 2 હોય તો ત્યારે જપ્ત થયેલ શેર ફરી બહાર પાડવા મહત્તમ વટાવ ..... આપી શકાય.
- (A) રૂ. 1 (B) રૂ. 2  
(C) રૂ. 3 (D) રૂ. 7
153. વિમાદારના મૃત્યુ વખતે પાકતી પોલિસીને ..... કહેવામાં આવે છે.
- (A) એન્ડાઉમેન્ટ પોલિસી (B) નફા સહિત પોલિસી  
(C) (A) અને (B) બંને (D) સંપૂર્ણ જીવન પોલિસી
154. વીમા કંપનીના મહેસૂલી ખાતામાં, પ્રિમિયમના ઘટાડામાં બોનસ ..... દર્શાવાય છે.
- (A) ખર્ચ તરીકે (B) આવક તરીકે  
(C) (A) અને (B) બંને (D) ઉપરનાં કોઈ નહીં
155. દાવાના સંદર્ભમાં વીમા કંપનીની કાયદાકીય ફી ..... દર્શાવામાં આવે છે.
- (A) નફા-નુકશાન ખાતે (B) મહેસૂલી ખાતે  
(C) નફા-નુકશાન ફાળવણી ખાતે (D) ઉપરનાં કોઈ નહીં
156. 1-4-1991 પહેલા , બેન્કિંગ કંપનીના કિસ્સામાં ખરાબ અને સંશયિત દેવાની જોગવાઈ ..... .
- (A) નફા-નુકશાન ખાતાની ઉધાર બાજુએ દર્શાવવામાં આવતી  
(B) નફા-નુકશાન ખાતાની જમા બાજુએ દર્શાવવામાં આવતી  
(C) પ્રકાશિત હિસાબોમા કોઈપણ જગ્યાએ દર્શાવાતી નહીં  
(D) ઉપરમાં થી કોઈ નહીં
157. રૂ. 80,000 ની ચોખ્ખી મિલકત માટે, રૂ.1,00,000 મૂળ કિંમતના ડિબેન્ચર10 % વટાવે બહાર પાડેલા છે, બાકીની રૂ. 10,000 ની રકમ કયા ખાતે ઉધારવામાં આવશે ?
- (A) પાઘડી ખાતે  
(B) મૂડી અનામત ખાતે  
(C) નફા-નુકશાન ખાતે  
(D) નફા-નુકશાન ફાળવણી ખાતે
158. ડિબેન્ચર ચૂકવણી બાદ, ડિબેન્ચરના સિંકિંગ ભંડોળની બાકી ..... ખાતે લઈ જવામાં આવે છે.
- (A) નફા-નુકશાન ખાતે (B) સામાન્ય અનામત ખાતે  
(C) ડિબેન્ચરના ખાતે (D) શેર પ્રિમિયમ ખાતે

152. If a share of Rs. 10, originally issued at a discount of Re. 1, is forfeited and the amount received on it was Rs. 2, the maximum discount on reissued of such forfeited share can be \_\_\_\_\_ .
- (A) Re. 1 (B) Rs. 2  
(C) Rs. 3 (D) Rs. 7
153. The insurance maturity only on the death of the insured is termed as \_\_\_\_\_ .
- (A) Endowment policy (B) With profit policy  
(C) Both (A) and (B) (D) Whole life policy
154. Bonus in reduction of premium appears in the revenue account of insurance company as \_\_\_\_\_ .
- (A) an expense (B) an income  
(C) Both (A) and (B) (D) None of the above
155. Legal fees of insurance company with respect to claim is shown in \_\_\_\_\_ .
- (A) P. & L. account (B) revenue account  
(C) P. & L. appropriation account (D) None of the above
156. Prior to 1-4-1991, the provision for the bad and doubtful debts of a banking company was \_\_\_\_\_ .
- (A) shown in debit side of P. & L. a/c  
(B) shown in credit side of P. & L. a/c  
(C) Nowhere shown in the published accounts  
(D) None of the above
157. If debentures of the nominal value of Rs. 1,00,000 are issued at a discount of 10% for net assets worth Rs. 80,000, the balance of Rs. 10,000 will be debited to which account?
- (A) Goodwill account  
(B) Capital reserve account  
(C) Profit and loss account  
(D) Profit and Loss appropriation account
158. After redemption, the balance of the sinking fund of debentures is transferred to \_\_\_\_\_ .
- (A) Profit and loss account (B) General reserve account  
(C) Debentures account (D) Share premium account

159. ડિબેન્ચરની ચૂકવણી માટે લેવામાં આવેલ વીમા પોલિસીના પ્રિમયમની ચૂકવેલ રકમ, હિસાબી વર્ષના અંતે ..... જમા કરવામાં આવે છે.
- (A) વીમા પોલિસી ખાતે  
(B) નફા-નુકશાન ખાતે  
(C) નફા-નુકશાન ફાળવણી ખાતે  
(D) ડિબેન્ચર ચૂકવણી ભંડોળ ખાતે
160. બેન્કિંગ કંપની માટે વટાવેલ હૂંડીનું વળતર એ .....
- (A) જવાબદારી છે. (B) ખર્ચ છે.  
(C) આવક છે. (D) ઉપરનાં કોઈ નહીં
161. સિંકિંગ ભંડોળ પધ્ધતિ દ્વારા ડિબેન્ચર પરત કરવાના કિસ્સામાં, દર વર્ષે નિશ્ચિત રકમ ..... લેવામાં આવે છે.
- (A) નફા-નુકશાન ખાતે  
(B) મૂડી અનામત ખાતે  
(C) નફા-નુકશાન ફાળવણી ખાતે  
(D) શેર પ્રિમયમ ખાતે
162. બેન્કિંગ કંપનીની ચૂકવેલ મૂડી ..... ની અડધી ( $\frac{1}{2}$ ) હોવી જોઈએ
- (A) અધિકૃત મૂડી (B) નોંધાયેલી મૂડી  
(C) મંગાવેલ મૂડી (D) ઉપરનાં કોઈ નહીં
163. ઈ-બેન્કિંગ એ બેન્કિંગની એવી પધ્ધતિ છે જેમાં ગ્રાહકો વ્યવહારો ઈલેક્ટ્રોનિક વ્યવસ્થા ..... દ્વારા કરે છે.
- (A) બેન્ક કેશ કાઉન્ટર (B) ચેકનું ક્લિયરીંગ  
(C) ચેકના ટ્રાન્સફર (D) ઈન્ટરનેટ
164. ધંધાકીય રોકાણો પર મળેલ ડિવિડન્ડ -
- (A) મૂડી આવક છે. (B) મહેસૂલી આવક છે.  
(C) મૂડી ખર્ચ છે. (D) મહેસૂલી ખર્ચ છે.
165. ન્યુયોર્કમાં ઓન લાઈન બેન્કિંગ સેવા ..... વર્ષમાં શરૂ થઈ.
- (A) 1980 (B) 1981  
(C) 1971 (D) 1991
166. ડિવિડન્ડ કોણ જાહેર કરે છે ?
- (A) બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ (B) શેર હોલ્ડર્સ  
(C) ચીફ એક્ઝ્યુક્યુટીવ ઓફિસર (CEO) (D) કંપની સેક્રેટરી

159. The amount paid as a premium for an insurance policy, taken for redemption of debenture, is credited to \_\_\_\_\_ at the end of the accounting period.
- (A) insurance policy account
  - (B) profit and loss account
  - (C) profit and loss appropriation account
  - (D) debenture redemption fund account**
160. For a banking company, the rebate on bills discounted is \_\_\_\_\_ .
- (A) a liability**
  - (B) an expense
  - (C) an income
  - (D) None of the above
161. In case of redemption of debentures by sinking fund method, every year a fixed amount is taken from \_\_\_\_\_ .
- (A) profit and loss account
  - (B) capital reserve account
  - (C) profit and loss appropriation account**
  - (D) share premium account
162. Paid up capital of a banking company must be one half of the \_\_\_\_\_ .
- (A) authorised capital
  - (B) subscribed capital**
  - (C) calledup capital
  - (D) None of the above
163. E-banking is a method of banking in which the customer conducts transactions electronically via \_\_\_\_\_ .
- (A) bank cash counter
  - (B) clearing of cheque
  - (C) transfer of cheque
  - (D) internet**
164. Dividends received on business investments is -
- (A) capital income
  - (B) revenue income**
  - (C) capital expenditure
  - (D) revenue expenditure
165. Online banking services started in New York in \_\_\_\_\_ .
- (A) 1980
  - (B) 1981**
  - (C) 1971
  - (D) 1991
166. Who declares the dividend?
- (A) Board of Directors
  - (B) Shareholders**
  - (C) Chief executive officer
  - (D) Company secretary

167. કઈ મૂડી બજેટ પધ્ધતિ ચોખ્ખું વર્તમાન મૂલ્ય શૂન્ય બતાવે છે ?
- (A) પરત આપ સમય પધ્ધતિ (B) હિસાબી વળતર દરની પધ્ધતિ  
(C) આંતરિક વળતરના દરની પધ્ધતિ (D) ચોખ્ખા વર્તમાન મૂલ્યની પધ્ધતિ
168. કઈ મૂડી બજેટ પધ્ધતિ નાણાંના સમયના મૂલ્યને ધ્યાનમાં લે છે ?
- (A) ચોખ્ખા વર્તમાન મૂલ્ય (B) પરત આપ સમય  
(C) હિસાબી વળતરનો દર (D) ઉપરનાં કોઈ નહીં
169. શેરનું બ્રેક-અપ મૂલ્ય ..... દ્વારા નિર્ધારિત કરી શકાય.
- (A) ઉપજ પધ્ધતિ (B) ચોખ્ખી મિલકતોની પધ્ધતિ  
(C) સ્ટોક એક્સ્ચેન્જના અવતરણ (D) સુપર નફાની ખરીદ પધ્ધતિ
170. PQR લી. નું ગિયરિંગ પ્રમાણ 30% છે. ઈક્વિટી પડતર 20% અને દેવાની પડતર 15% છે. કોર્પોરેટ કરનો દર 40% છે, તો મૂડી પડતરની ભારિત સરેરાશ (WACC) શું થશે ?
- (A) 16.70 (B) 17.22  
(C) 15.80 (D) 15.22
171. કિંમત ઉપજ પ્રમાણના આધારે શેરનું મૂલ્ય નક્કી કરતી વખતે, ..... સંબંધીત માહિતીની જરૂર પડે છે.
- (A) સામાન્ય વળતરનો દર (B) અસમાન્ય વળતરનો દર  
(C) ધંધામાં રોકાયેલી મૂડી (D) શેર દીઠ કમાણી
172. કાયમી મિલકતનો ઘસારો અસ્તિત્વના સમય પહેલાં અને પછી ..... ના પ્રમાણમાં વહેંચાય છે.
- (A) વેચાણ ગુણોત્તર (B) સમય ગુણોત્તર  
(C) મિલકત ગુણોત્તર (D) મૂડી ગુણોત્તર
173. કાર્યકારી (ઓપેરેટિંગ) લિવરેજ એટલે .....
- (A) ફાળો / કાર્યકારી નફો (B) કાર્યકારી નફો / કર પહેલાનો નફો  
(C) કાર્યકારી નફો / કર પછીનો નફો (D) ઉપરનાં કોઈ નહીં
174. ઈક્વિટી પરનો વેપાર ..... ઉપર વળતરની અસર દર્શાવે છે.
- (A) દેવાની મૂડી (B) પ્રેફરન્સ મૂડી  
(C) (A) અને (B) બંને (D) ઈક્વિટી મૂડી
175. એકત્રિત નુકશાન માંડી વળ્યા પછી, મૂડી ઘટાડા જાતાની બાકી ..... જાતે લઈ જવામાં આવે છે.
- (A) સામાન્ય અનામત (B) શેર મૂડી  
(C) મૂડી અનામત (D) નફા-નુકશાન જાતે

167. Which of the following capital budgeting techniques shows the net present value zero?  
 (A) Pay-back period method (B) Accounting rate of return method  
 (C) Internal Rate of Return Method (D) Net present value method
168. Which of the following Capital Budgeting Techniques recognizes the time value of money?  
 (A) Net Present Value (B) Pay-back Period  
 (C) Accounting Rate of Return (D) None of the above
169. Breakup value of share can be determined by \_\_\_\_\_.  
 (A) Yield method (B) Net assets method  
 (C) Stock exchange quotation (D) Purchase of super profits method
170. PQR Ltd. has gearing ratio of 30% the cost of equity is computed at 20% and the cost of debt is 15% the corporate tax rate is 40%. What will be weighted average cost of capital (WACC) ?  
 (A) 16.70 (B) 17.22  
 (C) 15.80 (D) 15.22
171. For determining the value of shares on the basis of price earnings ratio, information is required regarding \_\_\_\_\_.  
 (A) Normal rate of return (B) Abnormal rate of return  
 (C) Capital employed in business (D) Earnings per share
172. Depreciation of fixed assets should be divided between pre and post incorporation periods in .....  
 (A) Sales ratio (B) Time ratio  
 (C) Assets ratio (D) Capital ratio
173. Operating leverage means .....  
 (A) Contribution / Operating profit (B) Operating profit / profit before Tax  
 (C) Operating profit / profit after Tax (D) None of the above
174. Trading of equity shows the impact of return on .....  
 (A) Debt capital (B) Preference capital  
 (C) Both (A) and (B) (D) Equity capital
175. The balance in capital reduction account, after writing off the accumulated losses is transferred to .....  
 (A) General reserve (B) Share capital  
 (C) Capital reserve (D) Profit & loss account

176. ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ મુજબ, પેઢીનું મુલ્ય ..... હોય છે.  
 (A) તેના મૂડી માળખાથી સ્વતંત્ર (B) તેના મૂડી માળખાને આધારિત  
 (C) (A) અને (B) બંને (D) ઉપરનાં કોઈ નહીં
177. નવી કંપની Z લી. બનાવવા X લી. અને Y લી. ફંડમાં જાય છે. તે બાબત ..... ગણાય.  
 (A) સમાવેશ (B) બાહ્ય પુનઃરચના  
 (C) આંતરિક પુનઃરચના (D) જોડાણ
178. સમાવેશના સમયે, વેચનાર કંપની પ્રાથમિક ખર્ચાં ..... ફેરબદલ કરે છે.  
 (A) ખરીદ કંપની ખાતે (B) વસૂલાત ખાતે  
 (C) ઈકિવટી શેર હોલ્ડર ખાતે (D) ઉપરનાં કોઈ નહીં
179. જવાબદારી હિસાબી પધ્ધતિ એ ..... નો ભાગ છે.  
 (A) વૈશ્વિક જવાબદારી પધ્ધતિ (B) આંતરીક અહેવાલ પધ્ધતિ  
 (C) બાહ્ય અહેવાલ પધ્ધતિ (D) કોર્પોરેટ અહેવાલ પધ્ધતિ
180. ટ્રાન્સફર કિંમત એ ..... સાથે સંબંધિત છે.  
 (A) વ્યવસ્થાતંત્રના ઈન્ટ્રા વિભાગ  
 (B) આંતરીક વ્યવસ્થાતંત્ર ટ્રાન્સફર  
 (C) એક બહુરાષ્ટ્રીયથી બીજી બહુરાષ્ટ્રીય  
 (D) ઉપરનાં કોઈ નહીં
181. વેપાર જવાબદારી શેના આધારે ઉદભવે છે ?  
 (A) મિલકતોની ખરીદી (B) માલની ખરીદી  
 (C) ડિબેન્ચરની ખરીદી (D) ચૂકવવાના બાકી પગારની ખરીદી
182. એકત્રિત નફામાં ..... નો સમાવેશ હોય છે.  
 (A) સંશયિત દેવાની જોગવાઈઓ (B) કર્મચારીનો પ્રોવિડન્ટ ફંડ  
 (C) વીમા ફંડ (D) બેંક ઓવર ડ્રાફ્ટ
183. ટ્રાન્સફર કિંમતનીતી પધ્ધતિ હેઠળ વિભાગને ..... ગણવામાં આવે છે.  
 (A) પડતર કેન્દ્ર (B) રોકાણ કેન્દ્ર  
 (C) પધ્ધતિ કેન્દ્ર (D) નફા કેન્દ્ર

176. According to Net Operating Income approach, value of firm is \_\_\_\_\_.  
(A) Independent on its capital structure (B) Dependent on its capital structure  
(C) Both (A) and (B) (D) None of the above
177. X Ltd. and Y Ltd. go into liquidation to form a new company Z Ltd. It is a case of \_\_\_\_\_.  
(A) Absorption (B) External reconstruction  
(C) Internal reconstruction (D) Amalgamation
178. At the time of absorption, the preliminary expenses are transferred to \_\_\_\_\_ by the vendor company.  
(A) Purchasing company account (B) Realisation account  
(C) Equity shareholder's account (D) None of the above
179. Responsibility accounting is a part of \_\_\_\_\_.  
(A) Global Responsibility System (B) Internal Reporting System  
(C) External Reporting System (D) Corporate Reporting System
180. Transfer pricing is concerned with \_\_\_\_\_.  
(A) Intra-divisions of an Organisation  
(B) Inter-Organizational transfer  
(C) One multinational to another multinational  
(D) None of the above
181. Trade liabilities incurred on account of .....  
(A) Purchase of assets (B) Purchase of goods  
(C) Purchase of debentures (D) Purchase of outstanding salaries
182. Accumulated profits include .....  
(A) Provision for doubtful debts (B) Employee's provident fund  
(C) Insurance fund (D) Bank overdraft
183. Division under transfer pricing system is treated as .....  
(A) Cost centre (B) Investment centre  
(C) System centre (D) Profit centre

184. ખરીદી માટે સરકારને ચૂકવવાની બાકી રકમ એ ..... નું ઉદાહરણ છે.  
 (A) પસંદગીના લેણદારો (B) સલામત લેણદારો  
 (C) બિનસલામત લેણદારો (D) વિશિષ્ટ લેણદારો
185. સધ્ધર કંપનીના કિસ્સામાં, ડિબેન્ચરનું વ્યાજ ..... ની તારીખ સુધીનું ચૂકવાય.  
 (A) પાર્કુ સરવૈયું (B) ચૂકવણી  
 (C) સમાપનની શરૂઆતમાં (D) સમાપનના અંતે
186. ડિબેન્ચર હોલ્ડર્સ કે જેને ફ્લોટિંગ ચાર્જ છે તેને ..... કરતાં ચૂકવણીમાં અગ્રતા હોય છે.  
 (A) પસંદગીના લેણદારો (B) સલામત લેણદારો  
 (C) બિનસલામત લેણદારો (D) શેર હોલ્ડર્સ
187. લિક્વિડેટર્સ આખરી હિસાબનું પત્રક ..... બનાવે છે.  
 (A) સમાપન ની તમામ સ્થિતિઓમાં  
 (B) ફક્ત સભ્યના સ્વૈચ્છિક સમાપનના કિસ્સામાં  
 (C) ફક્ત ફરજિયાત સમાપનના કિસ્સામાં  
 (D) કોર્ટની દેખરેખ હેઠળના સમાપનના કિસ્સામાં
188. કંપનીના કર્મચારીઓને વેતન ચૂકવવા માટે આપેલ નાણાં પેશગી એ ..... સ્વરૂપના છે.  
 (A) સલામત લેણદારો (B) બિનસલામત લેણદારો  
 (C) પસંદગીના લેણદારો (D) ઉપરનાં કોઈ નહીં
189. ટ્રાન્સફર કિંમતનીતિની પ્રખ્યાત પધ્ધતિ ..... છે.  
 (A) પડતર આધારિત કિંમતનીતિ (B) બજાર આધારિત કિંમતનીતિ  
 (C) વાટાઘાટ કિંમતનીતિ (D) વૈકલ્પિક પડતર કિંમતનીતિ
190. ફડયામાં અથવા સમાપન આખરે ..... તરફ દોરી જાય છે.  
 (A) કંપનીની સ્થાપના (B) કંપનીની પુનઃરચના  
 (C) કંપનીની શરૂઆત (D) કંપનીનું વિસર્જન
191. પ્રવૃત્તિ આધારિત પડતર પધ્ધતિ એ ..... નું તાર્કિક વિતરણ છે.  
 (A) કુલ પડતર (B) શિરોપરી ખર્ચા  
 (C) પ્રત્યક્ષ પડતર (D) પ્રમાણ પડતર

184. Amount due to the government for purchases is an example of \_\_\_\_ .  
(A) Preferential creditor (B) Secured creditor  
(C) Unsecured creditor (D) Special creditor
185. In case a company is solvent, the interest on debentures is paid upto the date of \_\_\_\_ .  
(A) The balance sheet (B) Payment  
(C) The commencement of winding up (D) The ending of winding up
186. Debenture holders, having floating charge, have priority in payment over the \_\_\_\_ .  
(A) Preferential creditors (B) Secured creditors  
(C) Unsecured creditors (D) Shareholders
187. Liquidator's final statement of account is prepared \_\_\_\_ .  
(A) In all modes of winding up  
(B) Only in case of members voluntary winding up  
(C) Only in case of compulsory winding up  
(D) In case of winding up under the supervision of the court
188. Money advanced by director to the company to pay wages to the workers of the company is of the nature of a \_\_\_\_ .  
(A) Secured creditors (B) Unsecured creditors  
(C) Preferential creditors (D) None of the above
189. Popular method of transfer pricing is the \_\_\_\_ .  
(A) Cost based pricing (B) Market based pricing  
(C) Negotiated pricing (D) Opportunity cost pricing
190. Liquidation or winding up ultimately leads to \_\_\_\_ .  
(A) Formation of a company (B) Reconstruction of a company  
(C) Start up of a company (D) Dissolution of a company
191. Activity based costing is a logical distribution of \_\_\_\_ .  
(A) Total cost (B) Overheads  
(C) Direct cost (D) Standard cost

192. પાકા સરવૈયામાં ..... પરચુરણ ખર્ચ નથી.  
 (A) પ્રાથમિક ખર્ચ (B) અન્ડરરાઈટીંગ કમિશન  
 (C) શેર્સ પર આપેલ વટાવ (D) મૂડી ચાલુ કામ
193. જો ગૌણ કંપનીએ તેના શેર ઉપર ડિવિડન્ડ સૂચિત કર્યું હોય, પરંતુ શાસક કંપનીએ એ સૂચિત ડિવિડન્ડની કોઈ નોંધ પસાર કરી ન હોય તો એ સૂચિત ડિવિડન્ડની રકમ પાછી ..... ઉમેરાય છે.  
 (A) શાસક કંપનીનાં નફામાં (B) ગૌણ કંપનીના નફામાં  
 (C) (A) અને (B) બંને (D) ઉપરનાં કોઈ નહીં
194. જ્યારે પૂર્વ સંપાદિત નફામાંથી ડિવિડન્ડની સમગ્ર રકમ ચૂકવેલ હોય ત્યારે, ડિવિડન્ડની રકમ ..... જમા થાય છે.  
 (A) નફા-નુકશાન ખાતે (B) નફા-નુકશાન ફાળવણી ખાતે  
 (C) રોકાણ ખાતે (D) ઉપરનાં કોઈ નહીં
195. શાસક અને ગૌણ કંપનીઓ એકબીજાના શેરો ધરાવે તે સ્થિતિને ..... કહેવાય છે.  
 (A) ચેઈન હોલ્ડિંગ (B) વિશિષ્ટ હોલ્ડિંગ  
 (C) નકામુ હોલ્ડિંગ (D) કોસ હોલ્ડિંગ
196. ગૌણ કંપનીની લઘુમતી ..... મેળવવા પાત્ર છે.  
 (A) મૂડી નફો (B) મહેસૂલી નફો  
 (C) મૂડી અને મહેસૂલી નફો બંને (D) ઉપરનાં કોઈ નહીં
197. અંકુશ ખાતાની પડતર ..... માં જમા થાય છે.  
 (A) મહેસૂલી નફો (B) મુડી નફો  
 (C) મૂડી અને મહેસૂલી નફો બંને (D) ઉપરનાં કોઈ નહીં
198. મૂડી નફામાંથી ગૌણ કંપનીએ બહાર પડેલ બોનસ શેરથી .....  
 (A) અંકુશ પડતર પર કોઈ અસર નહીં થાય (B) અંકુશ પડતર વધશે  
 (C) અંકુશ પડતર ઘટશે (D) ઉપરનાં કોઈ નહીં
199. એકત્રિત પાકા સરવૈયામાં આંતર કંપનીનું ડિવિડન્ડ ખાતું ..... દર્શાવાય છે.  
 (A) મિલકતો બાજુ (B) જવાદારીઓ બાજુ  
 (C) (A) અથવા (B) (D) ક્યાંય નહીં
200. પાકા સરવૈયામાં આકસ્મિક જવાબદારી ક્યાં દર્શાવાય છે ?  
 (A) જવાબદારી તરીકે (B) મિલકત તરીકે  
 (C) ફૂટ નોટ તરીકે (D) ક્યાંય નહીં

192. The following is not miscellaneous expenditure in the balance-sheet.
- (A) Preliminary expenses (B) Underwriting commission  
(C) Discount allowed on shares (D) Capital work in progress
193. In case the subsidiary company has proposed a dividend on its shares but the holding company has not passed any entry for such dividend, the amount of the proposed dividend may be added back to \_\_\_\_\_ .
- (A) The holding company's profits (B) the subsidiary company's profits  
(C) Both (A) and (B) (D) None of the above
194. When entire amount of dividend is paid out of pre-acquisition profits, the amount of dividend is credited to \_\_\_\_\_ .
- (A) Profit and loss account (B) Profit and loss appropriation account  
(C) Investment account (D) None of the above
195. A situation where the holding and subsidiary companies own shares of each other, it is called \_\_\_\_\_ .
- (A) Chain holdings (B) Special holdings  
(C) Useless holding (D) Cross holdings
196. The minority of the subsidiary company is entitled to \_\_\_\_\_ .
- (A) Capital profits (B) Revenue profits  
(C) Both (A) and (B) (D) None of the above
197. Cost of control account is credited with \_\_\_\_\_ .
- (A) Revenue profits (B) Capital profits  
(C) Both (A) and (B) (D) None of the above
198. Issue of bonus shares by the subsidiary company out of capital profits will \_\_\_\_\_ .
- (A) Have no effect on cost of control (B) Increase cost of control  
(C) Decrease cost of control (D) None of the above
199. Inter-company owings on account of dividends will be shown in the consolidated balance sheet on \_\_\_\_\_ .
- (A) The assets side (B) The liabilities side  
(C) Either (A) or (B) (D) None of the above
200. Where is the contingent liabilities shown in the balance sheet ?
- (A) As liabilities (B) As assets  
(C) As a foot note (D) None of the above

201. પ્રવૃત્તિ આધારિત પડતર પધ્ધતિ ..... ઉપર આધારિત છે.
- (A) પડતર ઘટાડા (B) કામગીરી સંચાલન  
(C) અસરકારક પડતર અંકુશ (D) અસરકારક સંચાલન
202. ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે કુલ ચાલુ મિલકતો બાદ .....
- (A) માલસામગ્રી (B) રોકડ અને બેન્ક  
(C) કુલ ચાલુ જવાબદારીઓ (D) બેન્ક ઓવરડ્રાફ્ટ
203. સંચાલકીય હિસાબી પધ્ધતિનું મુખ્ય કાર્ય .....
- (A) સંચાલનને તેના કાર્યોની અસરકારક કામગીરીમાં મદદરૂપ થવાનું  
(B) તમામ ધંધાકીય વ્યવહારો નોંધવાનું  
(C) નાણાકીય માહિતીના અર્થઘટન કરવાનું  
(D) નાણાકીય માહિતીની ગણતરી કરવાનું
204. જીવન ચક્ર પડતર ..... સાથે સંબંધિત છે.
- (A) સંપાદન પડતર (B) સમગ્ર જીવન પડતર  
(C) કાર્યકારી પડતર (D) વિકાસ પડતર
205. જીવન ચક્ર પડતર પધ્ધતિ ..... માં ઉપયોગી છે.
- (A) મૂડી અંદાજપત્રના નિર્ણયો (B) સીમાંત પડતર પધ્ધતિના નિર્ણયો  
(C) એકમ પડતર પધ્ધતિના નિર્ણયો (D) પ્રમાણ પડતર પધ્ધતિના નિર્ણયો
206. Just-in-Time (JIT - સમયસર) એ વ્યૂહરચના ..... ને અસર કરે છે.
- (A) માલસામગ્રી અંકુશ (B) મિલકત અંકુશ  
(C) રોકડ અંકુશ (D) ઉપરનાં કોઈ નહીં
207. ખરીદીના કારણે કાયમી મિલકતોમાં વધારો એ .....
- (A) ભંડોળનો સ્ત્રોત (B) ભંડોળનો ઉપયોગ  
(C) વેચાણમાં વધારો (D) વેચાણમાં ઘટાડો
208. સમયસર (જસ્ટ ઈન ટાઈમ ) એ ..... ના સંકલન અને સમકાલીકરણની ખાતરી આપે છે.
- (A) તમામ કાર્યો (B) માલસામાન પ્રવાહ  
(C) ઉપરનાં (A) અને (B) (D) ઉપરનાં કોઈ નહીં

201. Activity Based Costing focuses on \_\_\_\_\_.  
(A) Cost reduction (B) Performance management  
(C) Effective cost control (D) Efficient management
202. Net working capital is total current assets less \_\_\_\_\_.  
(A) Inventories (B) Cash and bank  
(C) Total current liabilities (D) Bank Overdraft
203. The basic function of Management Accounting is to \_\_\_\_\_.  
(A) Assist the management in performing its function effectively  
(B) Record all business transactions  
(C) Interpret the financial data  
(D) Calculation of financial data
204. Lift Cycle cost is concerned with \_\_\_\_\_.  
(A) Acquisition cost (B) Whole life cost  
(C) Operating cost (D) Development cost
205. Life cycle costing is useful in \_\_\_\_\_.  
(A) Capital budgeting decisions (B) Marginal costing decisions  
(C) Unit costing decisions (D) Standard Costing decisions
206. Just-in-time (JIT) is an operating strategy that has significant effect on \_\_\_\_\_.  
(A) Inventory control (B) Asset control  
(C) Cash control (D) None of the above
207. The increase in the fixed assets because of purchases is the \_\_\_\_\_.  
(A) Source of fund (B) use of fund  
(C) increase in sales (D) decrease in sales
208. Just-in-Time (JIT) ensures coordination and synchronization of \_\_\_\_\_.  
(A) All Operations (B) Materials flows  
(C) Both A and B (D) None of the above

209. ચૂકવેલ કર એ .....
- (A) ભંડોળનો ઉપયોગ છે. (B) ભંડોળનો સ્ત્રોત છે.  
(C) કરદાતાની આવક છે. (D) ભંડોળનો પ્રવાહ નથી.
210. વર્ષના અંતનો સ્ટોક ..... માં પરિણમે છે.
- (A) વેચાણમાં વધારા (B) વેચાણમાં ઘટાડા  
(C) ભંડોળનો ઉપયોગ (D) ભંડોળનો સ્ત્રોત
211. .... એ ઓડિટનો પ્રકાર નથી.
- (A) વ્યક્તિગત ઓડિટ (B) બાહ્ય ઓડિટ  
(C) આંતરિક ઓડિટ (D) કર ઓડિટ
212. .... એ ઓડિટની રીત છે.
- (A) તપાસ (B) અવલોકન  
(C) પૂછપરછ (D) ઉપરનાં બધા જ
213. લાંબા ગાળાના રોકાણોનું વેચાણ ..... દર્શાવે છે.
- (A) ચાલુ મિલકતોમાં ફેરફાર (B) ચાલુ જવાબદારીમાં ફેરફાર  
(C) ભંડોળના સ્ત્રોત (D) ભંડોળનો ઉપયોગ
214. ઓડિટિંગ અને તપાસ એ .....
- (A) નકામાં છે (B) જરૂરી નથી  
(C) એકજ છે (D) એકજ નથી
215. એકમનું રોકડ પ્રવાહપત્રક ..... મુજબ તૈયાર કરવું જોઈએ.
- (A) IAS - 7 (B) IAS - 3  
(C) IFRS - 3 (D) IFRS - 10
216. મૂલ્ય વર્ધિત પત્રક (VAS) ને ..... નો અગત્યનો ભાગ ગણવામાં આવે છે.
- (A) કોર્પોરેટ સામાજિક અહેવાલ (B) વ્યક્તિગત અહેવાલ  
(C) વિભાગીય અહેવાલ (D) ઉપરનાં કોઈ નહીં
217. આર્થિક મૂલ્ય વર્ધિત (EVA) એ પેઢીના ..... નો અંદાજ છે.
- (A) ચોખ્ખો નફા (B) આર્થિક નફા  
(C) કાચો નફા (D) ઉપરનાં કોઈ નહીં

209. Tax paid is \_\_\_\_\_.  
(A) Application of funds (B) Source of funds  
(C) Income of tax payer (D) No flow of funds
210. Stock at the end of the year results in the \_\_\_\_\_.  
(A) increase in sales (B) decrease in sales  
(C) application of fund (D) source of fund
211. Which of the following is not a type of audit?  
(A) Personal Audit (B) External Audit  
(C) Internal Audit (D) Tax Audit
212. \_\_\_\_\_ is a technique of auditing  
(A) Inspection (B) observation  
(C) Enquiry (D) All of the above
213. Sale of long-term investments indicates \_\_\_\_\_.  
(A) Change in current assets (B) Change in current liabilities  
(C) Source of funds (D) Application of funds
214. Auditing and inspection are \_\_\_\_\_.  
(A) Useless (B) Not necessary  
(C) The same (D) Not the same
215. The cash flow statement of an entity should be prepared as per \_\_\_\_\_.  
(A) IAS - 7 (B) IAS - 3  
(C) IFRS - 3 (D) IFRS - 10
216. Value Added Statement (VAS) is regarded as an important part of \_\_\_\_\_.  
(A) Corporate Social Reporting (B) Personal Reporting  
(C) Segment Reporting (D) None of the above
217. Economics Value Added (EVA) is an Estimate of a firm's \_\_\_\_\_.  
(A) Net profit (B) Economic profit  
(C) Gross profit (D) None of the above

218. કંપની માટે મુખ્ય ધ્યેય ..... દ્વારા તેના શેરહોલ્ડરની સંપત્તિમાં વધારો કરવાનું છે.  
 (A) ડિવિડંડની ચુકવણી (B) શેરની કિંમતમાં વધારા  
 (C) (A) અને (B) બંને (D) ઉપરનાં કોઈ નહીં
219. મૂડી પ્રવાહના સ્વરૂપમાં વ્યવહારનો ..... માં સમાવેશ થતો નથી  
 (A) વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI)  
 (B) વૈશ્વિક ડિપોઝિટરી રસીદ (GDR)  
 (C) મૂડી માલ  
 (D) ઉપરનાં કોઈ નહીં
220. વિદેશી ચલણ હિસાબી પદ્ધતિ બે દેશો વચ્ચેના ..... ના વ્યવહારો ધ્યાનમાં લે છે.  
 (A) વેપાર સંબંધી માલ અને / અથવા સેવા (B) મૂડી માલ  
 (C) મૂડી પ્રવાહ (D) ઉપરનાં બધાજ
221. ડ્યુ પોન્ટ ચાર્ટ ..... એ વિકસાવ્યો.  
 (A) પ્રો. બ્લેક (B) પ્રો. વ્હાઈટ  
 (C) પ્રો. બ્રાઉન (D) પ્રો. ક્લાર્ક
222. નીચે મુજબની માહિતી આપવામાં આવેલ છે :  
 કુલ મિલકતો રૂ. 1,00,000  
 રોકાણ પર વળતર 20%  
 મૂડી ચાર્જિસ 12%  
 તો આર્થિક મૂલ્ય વર્ધિત (EVA) શું થશે ?  
 (A) રૂ. 20,000 (B) રૂ. 12,000  
 (C) રૂ. 32,000 (D) રૂ. 8,000
223. બે લેણદેણ કરતાં દેશો વચ્ચે વિદેશી હુંડિયામણનો દર, વ્યવહાર તારીખે ..... તરીકે ઓળખવામાં આવે છે.  
 (A) ફોરવર્ડ રેટ (B) બેકવર્ડ રેટ  
 (C) ડાયરેક્ટ રેટ (D) સ્પોટ રેટ
224. રોકડ પ્રવાહ પત્રકમાં, મળેલ વ્યાજ એ ..... ગણાય છે.  
 (A) નાણાંકીય પ્રવૃત્તિઓ (B) રોકાણ પ્રવૃત્તિઓ  
 (C) કાર્યકારી પ્રવૃત્તિઓ (D) ધંધાદારી પ્રવૃત્તિઓ
225. રોકડ પ્રવાહ પત્રકમાં, ચૂકવેલ ડિવિડંડ એ ..... ગણાય છે.  
 (A) કાર્યકારી પ્રવૃત્તિઓ (B) રોકાણ પ્રવૃત્તિઓ  
 (C) નાણાંકીય પ્રવૃત્તિઓ (D) કોર્પોરેટ પ્રવૃત્તિઓ

218. The primary goal of company is to increase the wealth of its shareholders by \_\_\_\_\_.  
(A) Paying dividends (B) Causing the stock price to increase  
(C) Both A and B (D) None of the the above
219. Transaction in the form of capital flows does not include \_\_\_\_\_.  
(A) Foreign direct investment(FDI)  
(B) Global Depository Receipts (GDR)  
(C) Capital Goods  
(D) None of the above
220. Foreign currency accounting considers \_\_\_\_\_ transactions between two countries.  
(A) The Mercantile goods and/or service (B) The Capital Goods  
(C) The Capital flows (D) All of the above
221. Du pont chart was developed by \_\_\_\_\_.  
(A) Prof. Black (B) Prof. White  
(C) Prof. Brown (D) Prof. Clerk
222. The following information is given:  
Total Assets - Rs. 1,00,000  
Return of Investment - 20%  
Capital Charges - 12%  
What will be Economic Value Added (EVA)?  
(A) Rs. 20,000 (B) Rs. 12,000  
(C) Rs. 32,000 (D) Rs. 8,000
223. The Foreign exchange rate between the two dealing countries on the transaction date is known as \_\_\_\_\_.  
(A) Forward rate (B) Backward rate  
(C) Direct rate (D) Spot rate
224. In the Cash flow statement, interest received is \_\_\_\_\_.  
(A) Financing activities (B) Investing activities  
(C) Operating activities (D) Business activities
225. In the Cash Flow Statement dividend paid is \_\_\_\_\_.  
(A) Operating activities (B) Investing activities  
(C) Financing activities (D) Corporate activities

226. શરૂઆતનો કાર્યકારી રોકડ પ્રવાહ મેળવવા માટે ઘસારાને .....
- (A) ચોખ્ખી આવકમાં પરત ઉમેરવો (B) ચોખ્ખી આવકમાંથી બાદ કરવો  
(C) મિલકતમાં પરત ઉમેરવો (D) મિલકતમાંથી બાદ કરવો
227. કોર્પોરેટ ગવર્નન્સ અનિવાર્યપણે કંપનીના હિતને ..... સાથે સંતુલિત કરે છે.
- (A) શેર હોલ્ડર્સ (B) સહભાગીઓ  
(C) સરકાર (D) સમાજ
228. કંપની ધારા 2013 મુજબ, દરેક કંપનીના બોર્ડમાં ..... ની નિમણૂક અનિવાર્ય છે.
- (A) એક રહેવાસી ડાયરેક્ટર (B) એક સ્વતંત્ર ડાયરેક્ટર  
(C) એક સ્ત્રી ડાયરેક્ટર (D) ઉપરના કોઈ નહીં
229. સ્ટોકના નુકશાનનો દાવો એ ..... ગણાય.
- (A) રોકાણ પ્રવૃત્તિ (B) નાણાકીય પ્રવૃત્તિ  
(C) કાર્યકારી પ્રવૃત્તિ (D) સ્ટોક પ્રવૃત્તિ
230. સેવા કર સૌ પ્રથમ વાર ..... વર્ષના અંદાજપત્રમાં પ્રસ્તુત કરવામાં આવ્યો.
- (A) 2010-11 (B) 1995-96  
(C) 2001-02 (D) 1994-95
231. ઈન્કમ ટેક્સ રીફંડ એ .....માંથી થતો રોકડ આવક પ્રવાહ છે.
- (A) કાર્યકારી પ્રવૃત્તિઓ (B) નાણાકીય પ્રવૃત્તિઓ  
(C) રોકાણ પ્રવૃત્તિઓ (D) આવક પ્રવૃત્તિઓ
232. આવકવેરાની જોગવાઈઓ વર્ષ 2015 માં રૂ. 40,000 અને વર્ષ 2016 માં રૂ. 50,000 છે. વર્ષ 2016. દરમ્યાન આવકવેરો રૂ. 35,000 ચૂકવેલ હતો. તો નફા-નુકશાન હવાલા ખાતે ..... ઉધારવામાં આવશે.
- (A) રૂ. 40,000 (B) રૂ. 50,000  
(C) રૂ. 45,000 (D) રૂ. 35,000
233. XYZ લિ. નીચેની માહિતી આપે છે :
- | વર્ષ        | 2015 (રૂ. લાખમાં) | 2016 (રૂ. લાખમાં) |
|-------------|-------------------|-------------------|
| ચાલુ મિલકતો | 65                | 95                |
| ચાલુ દેવાં  | 10                | 15                |
- તો 2016માં કાર્યશીલ મૂડીમાં કેટલો વધારો થશે ?
- (A) રૂ. 55 લાખ (B) રૂ. 25 લાખ  
(C) રૂ. 80 લાખ (D) ઉપરના કોઈ નહીં

226. In order to arrive at the operating cash flow, depreciation is \_\_\_\_\_.  
 (A) Added back to net income (B) Subtract from the net Income  
 (C) Added back to asset (D) Subtract from asset
227. Corporate governance essentially involves balancing the interests of a company with the \_\_\_\_\_.  
 (A) Shareholders (B) Many stakeholders  
 (C) Government (D) Community
228. Every company is required to appoint \_\_\_\_\_ on its board under the companies act, 2013  
 (A) One Resident director (B) One Independent director  
 (C) One woman director (D) None of the above
229. Claim for loss of stock is \_\_\_\_\_.  
 (A) investing activity (B) financing activity  
 (C) operating activity (D) stock activity
230. Service tax was first introduced in India in the budget of \_\_\_\_\_.  
 (A) 2010-11 (B) 1995-1996  
 (C) 2001-02 (D) 1994-95
231. Income tax Refund is cash inflow from\_\_\_\_\_  
 (A) operating activities (B) financially activities  
 (C) investing activities (D) income activities
232. Income tax provision for the year 2015 is Rs. 40,000 and Rs. 50,000 in the 2016. Income tax Rs. 35,000 was paid during the year 2016. The amount debited to the adjustment profit And loss account will be \_\_\_\_\_.  
 (A) Rs. 40,000 (B) Rs. 50,000  
 (C) Rs. 45,000 (D) Rs. 35,000
233. XYZ Ltd. gives the following data:
- | <i>Year</i>         | 2015 (Rs. Lakhs) | 2016 (Rs. Lakhs) |
|---------------------|------------------|------------------|
| Current Assets      | 65               | 95               |
| Current Liabilities | 10               | 15               |
- How Much Increase in working capital in the year 2016?  
 (A) Rs. 55 lakh (B) Rs.25 lakh  
 (C) Rs. 80 lakh (D) None of the Above

234. સેવા કર કોણ ચૂકવશે ?  
 (A) સેવા આપનાર  
 (B) સેવા મેળવનાર  
 (C) બીજી અન્ય વ્યક્તિ કે જે સેવા આપવા માટે જવાબદાર છે.  
 (D) ઉપરના બધાજ
235. સેવા કર કોણ એકત્રીત કરે છે ?  
 (A) કેન્દ્ર સરકાર (B) રાજ્ય સરકાર  
 (C) (A) અને (B) બંને (D) ઉપરના કોઈ નહીં
236. વર્ષ 2015માં એક કંપનીનું વેચાણ રૂ. 22 લાખ અને પડતર રૂ. 20 લાખ છે. જ્યારે વર્ષ 2016માં વેચાણ રૂ. 24 લાખ અને પડતર રૂ. 21 લાખ છે. તો કંપનીનો નફા-જથ્થા (P/V) ગુણોત્તર શું થશે ?  
 (A) 30% (B) 40%  
 (C) 50% (D) 60%
237. કંપનીની સ્થિર પડતર રૂ. 15,000 અને નફા-જથ્થા (P/V) ગુણોત્તર 20% છે. તો કંપનીનું સમતુલ્ય-બિંદુ (BEP) શું થશે ?  
 (A) રૂ. 15,000 (B) રૂ. 75,000  
 (C) રૂ. 30,000 (D) રૂ. 45,000
238. કંપનીનો માલસામાન રૂ. 40,000, મજૂરી રૂ. 20,000 અને શિરોપરી ખર્ચા રૂ. 30,000 (60% સ્થિર) છે. તો કુલ સીમાંત પડતર શું થશે ?  
 (A) રૂ. 40,000 (B) રૂ. 20,000  
 (C) રૂ. 30,000 (D) રૂ. 72,000
239. કરવેરા આયોજનમાં ઓછા કરની ચૂકવણી માટે કઈ કાયદેસરની ચૂકવણી છે ?  
 (A) કર પરિહાર (B) કર ચોરી  
 (C) કાળુ નાણું (D) ઉપરનાં કોઈ નહીં
240. પરોક્ષ ખર્ચા એ .....  
 (A) આવક ઉપરનો કર છે. (B) નફા ઉપરનો કર છે.  
 (C) પગાર ઉપરનો કર છે. (D) માલ અને સેવા ઉપર વસૂલાતો કર છે.
241. આવકવેરાના હેતુ માટે કરદાતાઓ અથવા વ્યક્તિઓ ..... વર્ગીકૃત કરવામાં આવે છે.  
 (A) ત્રણ કક્ષામાં (B) બે કક્ષામાં  
 (C) ચાર કક્ષામાં (D) ઉપરનાં કોઈ નહીં

234. Who will pay the Service Tax?  
 (A) Service provider  
 (B) Service receiver  
 (C) Any other person who is responsible for providing services  
 (D) All of the above
235. Who Collects the Service Tax?  
 (A) Central Government (B) State Government  
 (C) Both A and B (D) None of the above
236. A company has the sales of Rs. 22 lakh and the cost of Rs. 20 lakh in the year 2015 and the sales of Rs. 24 lakh and cost of Rs.21 lakh in 2016. What will be the P/V ratio of the company?  
 (A) 30% (B) 40%  
 (C) 50% (D) 60%
237. A company has Rs. 15000 fixed cost and 20% P/V ratio. What will be Break-even-point (BEP) of the company?  
 (A) Rs. 15,000 (B) Rs. 75,000  
 (C) Rs. 30,000 (D) Rs. 45,000
238. A Company has Material Rs. 40,000, Labour Rs. 20,000 and overheads Rs. 30,000 (60% fixed). What will be the Marginal cost in total?  
 (A) Rs. 40,000 (B) Rs. 20,000  
 (C) Rs. 30,000 (D) Rs. 72,000
239. In tax planning ,which one is legal for payment of less tax?  
 (A) Tax Avoidance (B) Tax Evasion  
 (C) Black money (D) None of The above
240. Indirect tax is \_\_\_\_\_.  
 (A) A tax on income (B) A tax on profits  
 (C) A tax on salaries (D) A tax levied on goods and services
241. For Income-tax purpose, tax payers or persons are classified into the \_\_\_\_\_.  
 (A) Three Categories (B) Two Categories  
 (C) Four Categories (D) None of the above

242. ક્યુ અંદાજપત્ર માલસામાન અંદાજપત્ર, મજૂરી અંદાજપત્ર અને શિરોપરી ખર્ચા અંદાજપત્રમાં વર્ગીકૃત કરી શકાય ?
- (A) ખરીદ અંદાજપત્ર (B) વેચાણ અંદાજપત્ર  
(C) રોકડ અંદાજપત્ર (D) ઉત્પાદન પડતર અંદાજપત્ર
243. અંદાજિત નફા -નુકશાન ખાતું અને પાર્કુ સરવેયું સામાન્ય રીતે ક્યા અંદાજપત્ર હેઠળ લેવામાં આવે છે.
- (A) કાર્યકારી અંદાજપત્ર (B) મુખ્ય અંદાજપત્ર  
(C) સ્થિર અંદાજપત્ર (D) પરિવર્તનશીલ અંદાજપત્ર
244. ક્યું અંદાજપત્ર પ્રવૃત્તિની વિવિધ સપાટીએ વિવિધ અંદાજિત પડતર આપે છે ?
- (A) મુખ્ય અંદાજપત્ર (B) સ્થિર અંદાજપત્ર  
(C) પરિવર્તનશીલ અંદાજપત્ર (D) કાર્યકારી અંદાજપત્ર
245. આવકવેરાના હેતુ માટે, આવકના મથાળા (હેડ્સ) ..... વર્ગીકૃત કરવામાં આવે છે ?
- (A) છ કક્ષામાં (B) પાંચ કક્ષામાં  
(C) ચાર કક્ષામાં (D) ઉપરનાં કોઈ નહીં
246. ક્યા અંદાજપત્રમાં અંદાજપત્ર લખવાની તૈયારી કોરી પાટી પર થાય છે ?
- (A) શૂન્ય આધારીત અંદાજપત્ર (B) કામગીરી અંદાજપત્ર  
(C) મુખ્ય અંદાજપત્ર (D) રોકડ અંદાજપત્ર
247. આવકવેરા રીટર્ન ..... વર્ગીકૃત કરવામાં આવે છે.
- (A) બે કક્ષામાં (B) ત્રણ કક્ષામાં  
(C) પાંચ કક્ષામાં (D) ઉપરનાં કોઈ નહીં
248. ખેતીવાડીની આવકને કઈ કલમના આધારે કરમાંથી મુક્તિ મળે છે ?
- (A) કલમ 10(1) (B) કલમ 10(a)  
(C) કલમ 10 (D) કલમ 10(2)
249. ભારતીય કરવેરા પધ્ધતિમાં મૂલ્ય વર્ધિત કર ..... થી દાખલ કરવામાં આવેલ હતો
- (A) 1 એપ્રિલ, 2001 (B) 1 એપ્રિલ, 2005  
(C) 1 એપ્રિલ, 2006 (D) 1 એપ્રિલ, 2010
250. શૂન્ય આધારિત અંદાજપત્ર એ ..... .
- (A) નિર્ણય પ્રેરિત અભિગમ છે (B) હિસાબી પધ્ધતિ પ્રેરિત અભિગમ છે  
(C) સંચાલન પ્રેરિત અભિગમ છે (D) ઉપરનાં કોઈ નહીં

242. Which budget may be classified into material cost budget, labour cost budget and overhead budget?
- (A) Purchase budget (B) Sales budget  
(C) Cash budget (D) Cost of Production budget
243. The budget which commonly takes the form of budgeted profit and loss account and balance sheet is\_\_\_\_\_.
- (A) Performance budget (B) Master budget  
(C) Fixed budget (D) flexible budget
244. Which budget gives different budgeted costs for different level of activity?
- (A) Master budget (B) Fixed budget  
(C) flexible budget (D) performance budget
245. For Income-tax purpose, heads of Income is classified into\_\_\_\_\_
- (A) Six Categories (B) Five Categories  
(C) Four Categories (D) None of the above
246. The following budget is the preparation of budget writing on a clean slate
- (A) Zero Base Budget (B) Performance Budget  
(C) Master Budget (D) Cash Budget
247. The Income-Tax returns are classified into\_\_\_\_\_.
- (A) Two Categories (B) Three Categories  
(C) Five Categories (D) None of the above
248. Agriculture income is exempt from tax by virtue of which section?
- (A) Section 10 (1) (B) Section 10 (a)  
(C) Section 10 (D) Section 10 (2)
249. Value Added tax was introduced into the Indian taxation system from\_\_\_\_\_.
- (A) 1st April ,2001 (B) 1st April ,2005  
(C) 1st April ,2006 (D) 1st April ,2010
250. Zero base budgeting is a \_\_\_\_\_.
- (A) Decision oriented approach (B) Accounting oriented approach  
(C) Management oriented approach (D) None of the above

251. કંપની પોતાના વર્તમાન વેચાણ પર 25% સલામતી ગાળો રાખે છે અને વાર્ષિક રૂ. 30 લાખ નફો કમાય છે. જો કંપનીનો નફા-જથ્થા (p/v) ગુણોત્તર 40% હોય તો વર્તમાન વેચાણની રકમ કેટલી થશે ?
- (A) રૂ. 200 લાખ (B) રૂ. 250 લાખ  
(C) રૂ. 300 લાખ (D) રૂ. 400 લાખ
252. નીચેના પૈકી કઈ પડતરની રીત છે ?
- (A) પ્રક્રિયા પડતર પધ્ધતિ (B) સીમાંત પડતર પધ્ધતિ  
(C) કરાર પડતર પધ્ધતિ (D) ઉપરની કોઈ નહીં
253. મૂલ્ય વર્ધિત કર એ ..... નો પ્રકાર છે.
- (A) સેવા કર (B) આવક કર  
(C) વપરાશ કર (D) ઉપરનાં કોઈ નહીં
254. 2 જૂન, 2014 ના રોજ , ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો મૂલ્ય વર્ધિત કર અમલમાં મૂકવામાં આવ્યો સિવાય કે .....
- (A) આંદમાન નિકોબાર ટાપુઓ (B) લક્ષ્યદીપ ટાપુઓ  
(C) (A) અને (B) બંને (D) ઉપરનાં કોઈ નહીં
255. પ્રવૃત્તિની તમામ સપાટીએ, સ્થિર પડતર બદલાતી નથી એવું ..... હેઠળ ધારવામાં આવે છે.
- (A) સમતુટ બિંદુ વિશ્લેષણ (BEP) (B) પડતર-જથ્થા-નફો વિશ્લેષણ (CVP)  
(C) સીમાંત પડતર પધ્ધતિ (D) ઉપરનાં બધાજ
256. પ્રમાણ પડતર એ ..... છે.
- (A) ઐતિહાસિક પડતર (B) પૂર્વ નિર્ધારિત પડતર  
(C) વાસ્તવિક પડતર (D) સ્થિર પડતર
257. પ્રમાણ પડતર અથવા નફો અથવા વેચાણ થી વાસ્તવિક પડતર અથવા નફો અથવા વેચાણનું ફેરફાર એ ..... તરીકે ઓળખવામાં આવે છે.
- (A) અસંગતી (B) તફાવત  
(C) વિચલન (D) અસાતત્ય
258. માલસામાન વપરાશ વિચલન = માલસામાન મિશ્ર વિચલન + .....
- (A) માલસામાન ઉપજ વિચલન (B) માલસામાન પડતર વિચલન  
(C) માલસામાન કિંમત વિચલન (D) ઉપરનાં કોઈ નહીં

251. A Company maintains a margin of safety of 25% on its current sales and earns a profit of Rs. 30 lakh per annum. If the company has a P/V ratio of 40% its current sales amounts to \_\_\_\_\_.
- (A) Rs. 200 lakh (B) Rs. 250 lakh  
 (C) Rs. 300 lakh (D) Rs. 400 lakh
252. Which of the following is the technique of costing?
- (A) Process costing (B) Marginal costing  
 (C) Contract costing (D) None of the above
253. Value Added Tax is a type of \_\_\_\_\_.
- (A) Service tax (B) Income tax  
 (C) Consumption tax (D) None of the Above
254. As on 2 June, 2014, Value Added Tax has been implement in all states and union territories of India, except \_\_\_\_\_.
- (A) Andaman and Nicobar Islands (B) Lakshadweep Islands  
 (C) Both A and B (D) None of the above
255. Fixed cost remains unchanged at all level of activity is assumed under the \_\_\_\_\_.
- (A) BEP Analysis (B) CUP Analysis  
 (C) Marginal costing (D) All of the above
256. Standard cost is a \_\_\_\_\_.
- (A) Historical cost (B) Predetermined cost  
 (C) Actual cost (D) Fixed cost
257. The deviation of the actual cost or profit or sales from standard cost or profit or sales is known as \_\_\_\_\_.
- (A) Discrepancy (B) Difference  
 (C) Variance (D) Inconsistency
258. Material Usage variance = Material Mix variance + \_\_\_\_\_.
- (A) Material yield variance (B) Material cost variance  
 (C) Material price variance (D) None of the above

259. અનુકૂળ વિચલન ઉદભવે છે જ્યારે મૂડી આવક ..... .
- (A) અપેક્ષા કરતાં ઓછી હોય (B) અપેક્ષા કરતાં વધારે હોય  
(C) અપેક્ષા કરતાં વધુ ઓછી હોય (D) ઉપરનાં કોઈ નહીં
260. પૂર્વ નિર્ધારિત પ્રમાણના ફેરફારોના અહેવાલથી સંચાલનનો સમય બચાવવામાં આવે તેને ..... કહેવાય.
- (A) પ્રમાણ પડતર પધ્ધતિ (B) સીમાંત પડતર પધ્ધતિ  
(C) અપવાદ દ્વારા સંચાલન (D) પડતર-જથ્થા-નફા વિશ્લેષણ (CVP)
261. નિષ્ક્રિય સમય વિચલન એ હંમેશા ..... હોય છે.
- (A) અનુકૂળ (B) બિન અનુકૂળ  
(C) (A) અને (B) બંને (D) ઉપરનાં કોઈ નહીં
262. સમતુલિત સ્કોર કાર્ડ પધ્ધતિ 1987માં ક્યાં સર્જવામાં આવી હતી ?
- (A) એનાલોગ ડીવાઈસિસ (B) સોફ્ટવેર ડીવાઈસિસ  
(C) હાર્ડવેર ડીવાઈસિસ (D) ઉપરનાં કોઈ નહીં
263. સમતુલિત સ્કોર કાર્ડ ..... નો સમાવેશ કરે છે.
- (A) નાણાકીય માપ (B) નાણાકીય અને બિન નાણાકીય માપ  
(C) આર્થિક માપ (D) ઉપરનાં કોઈ નહીં
264. નીચેના પૈકી કયું નિષ્ક્રિય સમય વિચલનનું કારણ નથી
- (A) યંત્ર વિરામ (B) કામદારની ઈજા  
(C) માલસામાનની અપ્રાપ્યતા (D) મજૂરીદર વધારો
265. IAS - 1 પ્રમાણે એકમ તેના નાણાકીય પત્રકો માટે કઈ હિસાબી પધ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી છે ?
- (A) સંચયના આધારે (B) રોકડ આધારે  
(C) સંકર પધ્ધતિ (D) ઉપરના બધા જ
266. અનુકૂળ વિચલન ..... તરીકે પણ ઓળખાય છે.
- (A) ઉધાર વિચલન (B) જમા વિચલન  
(C) (A) અને (B) બંને (D) ઉપરનાં કોઈ નહીં
267. આંતરરાષ્ટ્રીય હિસાબી પધ્ધતિનું નિયમન ..... કરે છે.
- (A) આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણો  
(B) આંતરરાષ્ટ્રીય નાણાકીય અહેવાલ ધોરણો  
(C) (A) અને (B) બંને  
(D) ઉપરનાં કોઈ નહીં

259. A favorable variance will arise when capital revenues are \_\_\_\_\_.  
(A) Less than expected (B) More than expected  
(C) Lesser than expected (D) None of the above
260. The management's time is saved by reporting only the deviations from the predetermined standard is called \_\_\_\_\_.  
(A) Standard costing (B) Marginal Costing  
(C) Management by exceptions (D) CVP analysis
261. Idle time variance is always \_\_\_\_\_.  
(A) Favorable (B) Unfavorable  
(C) Both A and B (D) None of the Above
262. Balanced scorecard system was created in 1987 at \_\_\_\_\_.  
(A) Analog Devices (B) Software Devices  
(C) Hardware Devices (D) None of the above
263. Balanced scorecard includes \_\_\_\_\_.  
(A) Financial Measures  
(B) Financial and Non-Financial measures  
(C) Monetary Measures  
(D) None of the above
264. Which of the following is not a reason for an idle time variance?  
(A) Machine break down (B) Injury of worker  
(C) Non-availability of material (D) Wage rate increase
265. IAS-1 requires an entity to prepare its financial statements using the \_\_\_\_\_ accounting system  
(A) Accrual basis (B) Cash basis  
(C) Hybrid Method (D) All of the above
266. Favorable variance is also known as \_\_\_\_\_.  
(A) Debit variance (B) Credit Variance  
(C) Both A and B (D) None of the above
267. The International Accounting is governed by \_\_\_\_\_.  
(A) International Accounting Standards  
(B) International Financial Reporting standards  
(C) Both A and B  
(D) None of the above

268. આંતરરાષ્ટ્રીય નાણાકીય અહેવાલ ધોરણો (IFRS) નિયમો અને માર્ગદર્શિકાનો સેટ ..... દ્વારા વિકસાવવામાં અને બહાર પાડવામાં આવે છે.
- (A) આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણો (B) હિસાબી ધોરણો સમિતિ  
(C) (A) અને (B) બંને (D) આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ બોર્ડ
269. જ્યારે ઉત્પાદન વિભાગનો ક્ષમતા વપરાશ ગુણોત્તર 99% છે. અને પ્રવૃત્તિ ગુણોત્તર 90% છે. તો વિભાગનો કાર્યક્ષમતા ગુણોત્તર ..... છે.
- (A) 100% (B) 110%  
(C) 80% (D) 90 %
270. આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણો સમિતિ (IASB) ના પુનઃ રચનાને પરિણામે આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણો બોર્ડ (IASB) ની સ્થાપના ..... ના દિવસે કરવામાં આવી.
- (A) 1 એપ્રિલ, 2001 (B) 1 એપ્રિલ, 2010  
(C) 1 એપ્રિલ, 1969 (D) 29 જૂન, 1973
271. કયો દર વર્તમાન વિનિમય દર દર્શાવે છે ?
- (A) ઐતિહાસિક દર (B) વિનિમય દર  
(C) વ્યાજ દર (D) સ્પોટ દર
272. નફા કેન્દ્ર એ ..... .
- (A) પડતર સંચાલિત કરે છે.  
(B) શેર હોલ્ડરને મદદ કરે છે.  
(C) સંચાલકને નફો કરવાની અને વધારવાની જવાબદારીનું કેન્દ્ર છે.  
(D) ઉપરના કોઈ નહીં
273. અવતરણના આધારે કયો વિનિમય દર થાય છે ?
- (A) ફોરવર્ડ વિનિમય દર (B) સ્પોટ વિનિમય દર  
(C) વેચાણ દર (D) અસરકારક વિનિમય દર
274. કંપનીની કામગીરી માપદંડ માટે કયું વધારે સારું છે ?
- (A) નફા-નુકશાન ખાતું (B) મૂલ્ય વર્ધિત પત્રક  
(C) આર્થિક મૂલ્ય વર્ધિત (D) રોકાયેલ મૂડી પર વળતર
275. ઉત્પાદનની પડતરના મૂળતત્ત્વો ..... છે.
- (A) ફક્ત માલસામગ્રી (B) ફક્ત મજૂરી  
(C) ફક્ત ખર્ચા (D) ઉપરનાં બધા જ

268. IFRSs represent a set of rules and guidelines developed and issued by \_\_\_\_\_.  
(A) International Accounting Standards  
(B) Accounting standard committee  
(C) Both A and B  
(D) International Accounting Standard Board
269. If the capacity usage ratio of a production department is 99% and activity ratio is 90%, then the efficiency ratio of the department is \_\_\_\_\_.  
(A) 100% (B) 110%  
(C) 80% (D) 90%
270. International Accounting Standard Committee (IASC) was restructured resulting in the formation of International Accounting Standard Board (IASB) on \_\_\_\_\_.  
(A) 1 April, 2001 (B) 1 April, 2010  
(C) 1 April, 1969 (D) 1 April, 1973
271. Which rate refers to the current exchange rate?  
(A) Historical rate (B) Exchange rate  
(C) Interest rate (D) Spot rate
272. A Profit centre is a centre \_\_\_\_\_.  
(A) Which manages cost  
(B) Which helpful to shareholders  
(C) Where the Manager has the responsibility of generating and maximizing profits  
(D) None of the above
273. Which Exchange rate is based on quotation?  
(A) Forward exchange rate (B) Spot exchange rate  
(C) Selling rate (D) Effective exchange rate
274. Which is the better measurement of performance of a company?  
(A) Profit and Loss Account (B) Value Added Statement  
(C) Economic Value Added (D) Return on Capital Employed
275. Elements of cost of production are \_\_\_\_\_.  
(A) Material only (B) Labor only  
(C) Expenses only (D) All of the above

276. ડૂબેલી પડતર એ ..... છે.
- (A) ભવિષ્યમાં ઉદભવતી પડતર (B) નિર્ણય કરવા માટે સંબંધિત  
(C) નિર્ણય કરવા માટે અસંબંધિત (D) ઉપરનાં કોઈ નહીં
277. ક્યાં સંજોગોમાં મર્યાદિત (Qualified) અહેવાલ આપી શકાય ?
- (A) જ્યારે કાયદા મુજબ હિસાબી ચોપડા રાખવામા આવે ત્યારે  
(B) જ્યારે કાયદા મુજબ હિસાબી ચોપડા રાખવામા ના આવે ત્યારે  
(C) (A) અને (B) બંને  
(D) ઉપરનાં કોઈ નહીં
278. પેદાશની પડતર રૂ.10,000 અને વેચાણ કિંમત પર નફો25 % છે. તો નફો શું થશે ?
- (A) રૂ. 2,000 (B) રૂ. 2,500  
(C) રૂ. 3,000 (D) રૂ. 3,333
279. આર્થિક વરધી જથ્થો એ એવો જથ્થો છે જ્યાં રાખવાની અને વહન માલસામગ્રીની પડતર ..... છે.
- (A) લઘુતમ અને સરખી (B) મહતમ અને સરખી  
(C) (A) અને (B) બંને (D) ઉપરનાં કોઈ નહીં
280. નીચેના પૈકી કઈ માલસામગ્રી મૂલ્યાંકન પધ્ધતિ નથી ?
- (A) ફિફો (FIFO) (B) લીફો (LIFO)  
(C) હિફો (HIFO) (D) આર્થિક વરધી જથ્થો (EOQ)
281. અસામાન્ય બગાડની પડતર .....
- (A) પેદાશ પડતર માં લખાય છે. (B) નફા-નુકશાન ખાતે લખાય છે.  
(C) (A) અને (B) બંને (D) ઉપરનાં કોઈ નહીં
282. મજૂર ઊથલો એટલે .....
- (A) મજૂર દ્વારા નિર્માણ ઊથલો  
(B) વેતન દ્વારા નિર્માણ ઊથલો  
(C) સમય દરમ્યાન મજૂરબળની રચનાના દરમાં ફેરફાર  
(D) ઉપરનાં કોઈ નહીં

276. Sunk cost is \_\_\_\_\_.  
(A) Cost to be incurred in future (B) Relevant for decision making  
(C) Not relevant for decision making (D) None of the above
277. In which circumstances qualified report can be given?  
(A) Where the books of account are maintained as required by law  
(B) Where the books of account are not maintained as required by law  
(C) Both A and B  
(D) None of the above
278. Total cost of product is Rs. 10,000 and profit is 25% on selling price. What will be the profit?  
(A) Rs. 2,000 (B) Rs. 2,500  
(C) Rs. 3000 (D) Rs. 3,333
279. Economic Order Quantity (EOQ) is that quantity at which cost of holding and carrying inventory is \_\_\_\_\_.  
(A) Minimum and equal (B) Maximum and Equal  
(C) Both A and B (D) None of The Above
280. Which one, out of the following, is not an inventory valuation method?  
(A) FIFO (First in First Out) (B) LIFO (Last in First out)  
(C) HIFO (Highest in First Out) (D) EOQ (Economic Order quantity)
281. Cost of abnormal Wastage is \_\_\_\_\_.  
(A) Charges to the product cost (B) Charged to profit and loss account  
(C) Both A and B (D) None of the above
282. Labour turnover means \_\_\_\_\_.  
(A) Turnover generated by labor  
(B) Turnover generated by wages  
(C) Rate of change in composition of labour force during a period  
(D) None of the above

283. શિરોપરી ..... સાથે સંલગ્ન છે.
- (A) બધી જ પરોક્ષ પડતર (B) પ્રત્યક્ષ અથવા મુખ્ય પડતર  
(C) ફક્ત પ્રત્યક્ષ ખર્ચા (D) ફક્ત કારખાના પરોક્ષ પડતર
284. સ્થાનિક સત્તા તેના કચરા નિકાલ વિભાગ માટે અંદાજપત્ર તૈયાર કરે છે. રોકડ અંદાજપત્રમાં નીચેના પૈકી કઈ વિગતનો સમાવેશ થશે નહીં ?
- (A) કાર્યકારી મજૂરી (B) નવા ઉઘરાણી વાહનની મૂડી પડતર  
(C) વાહનનો ઘસારો (D) વાહન માટે ઈંધણ
285. નીચેના પૈકી કયા વ્યવસ્થા તંત્ર માટે સેવા પડતર પધ્ધતિ ભલામણ કરી શકાય નહીં
- (A) હોસ્પિટલ (B) હળવી એંજિનયરિંગ કંપની  
(C) વહેંચણી સેવા (D) ઉપરનાં કોઈ નહીં
286. જવાબદારી હિસાબી પધ્ધતિ એ ..... માપવાનું સાધન છે.
- (A) વિભાગીય કામગીરી (B) વ્યક્તિગત કામગીરી  
(C) સાહસ કામગીરી (D) ઉપરના કોઈ નહીં
287. નફા કેન્દ્ર એ વ્યવસ્થાતંત્રનો એવો વિભાગ છે કે જેમાં ..... ના આધારે નાણાંકીય કામગીરી મપાય છે.
- (A) ખરીદી (B) પડતર  
(C) વેચાણ (D) નફા
288. અંકુશીત ચલિત પડતર એ એવી પડતર છે કે જેના દ્વારા ..... પ્રત્યક્ષ રીતે અંકુશીત છે.
- (A) મેનેજિંગ ડાયરેક્ટર (B) બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ  
(C) વિભાગીય સંચાલક (D) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
289. રોકાણ કેન્દ્ર ..... ધ્યાનમાં લે છે.
- (A) ફક્ત પડતર (B) ફક્ત મિલકત  
(C) ફક્ત મહેસૂલ (D) ઉપરનાં બધા જ
290. નીચેનામાંથી કયા પક્ષકારને ઓડિટરે અહેવાલ સંબોધિત કરવો જોઈએ ?
- (A) કંપનીના શેર હોલ્ડર્સ (B) કેન્દ્ર સરકાર  
(C) કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ (D) ઉપરનાં કોઈ નહીં
291. પડતરના હિસાબો એ આંશિક રીતે હકીકત અને આંકડા સાથે અને આંશિક રીતે ..... સાથે સંબંધિત છે.
- (A) પડતર (B) આવક  
(C) મહેસૂલ (D) અંદાજ

283. Overhead refers to \_\_\_\_.
- (A) All Indirect cost (B) Director prime cost  
(C) Only Direct Expenses (D) Only factory indirect cost
284. A local authority is preparing cash budget for its waste disposal department. Which of the following item would not be included in cash budget?
- (A) Operating wages (B) Capital cost of new collection vehicles  
(C) Depreciation of the vehicles (D) Fuel for the vehicles
285. Which of the following organizations should not be advised to use service costing?
- (A) Hospital (B) A light engineering company  
(C) Distribution service (D) None of the above
286. Responsibility accounting is a device to measure \_\_\_\_.
- (A) Divisional performance (B) Individual performance  
(C) Enterprise performance (D) None of the above
287. Profit centre is a segment of an organization in which financial performance is measured on the basis of the \_\_\_\_.
- (A) Purchases (B) Cost  
(C) Sales (D) Profit
288. Controllable variable costs are costs directly controllable by \_\_\_\_.
- (A) The Managing Director (B) The board of Director  
(C) The Divisional Manager (D) The Chartered Accountant
289. Investment centers consider \_\_\_\_.
- (A) Cost only (B) Asset only  
(C) Revenue only (D) All of the above
290. To which of the following is the auditor expected to address his report?
- (A) Shareholders of the company (B) Central government  
(C) Board of Directors of the company (D) None of the above
291. Cost accounts deal partly with facts and figures and partly with \_\_\_\_.
- (A) Cost (B) Income  
(C) Revenue (D) Estimate

292. એકમ દીઠ ચલિત પડતર ..... રહે છે.  
 (A) સતત (B) ચલિત  
 (C) (A) અને (B) બંને (D) ઉપરનાં કોઈ નહીં
293. એકમ પડતર એ પેદાશનું એકમ અથવા સેવાનું એકમ છે કે જેની પડતર ..... દ્વારા નક્કી કરવામાં આવે છે.  
 (A) વહેંચણી (B) વિભાજન  
 (C) સમાવેશ (D) ઉપરનાં બધા જ
294. કંપની પાસે રૂ. 2,50,000 ના ઈક્વિટી શેર અને તેનો કર બાદ નફો રૂ. 10 લાખ અને શેરની શેર દીઠ બજાર કિંમત રૂ. 50 છે. તો કંપનીનો કિંમત આવક ગુણોત્તર (P/E) શું થશે ?  
 (A) રૂ. 10.00 (B) રૂ. 12.50  
 (C) રૂ. 25.00 (D) રૂ. 15.00
295. નીચે પૈકી કઈ બાબતનો રોકડ અંદાજપત્રમાં સમાવેશ થતો નથી ?  
 (A) અગાઉથી ચૂકવેલ ભાડું (B) ચૂકવેલ આવકવેરો  
 (C) માંડી વળેલ પાઘડી (D) મળેલ ડિવિડંડ
296. જ્યારે વેચાણ રૂ. 40,000 થી વધીને રૂ. 60,000 અને નફો રૂ. 5,000 વધે ત્યારે નફા-જથ્થા ગુણોત્તર (P/V) ..... થશે.  
 (A) 20% (B) 25%  
 (C) 30% (D) 35%
297. 'બનાવવું કે ખરીદવું' નિર્ણયમાં, ફક્ત બહારથી ખરીદવું ત્યારેજ નફાકારક છે કે જ્યારે વિકેતાની કિંમત પેઢીની ..... કિંમત કરતાં નીચી હોય.  
 (A) કુલ પડતર (B) ડૂબેલી પડતર  
 (C) સ્થાયી પડતર (D) ચલિત પડતર
298. કંપનીનું સમતુટ બિંદુ વાર્ષિક 6,000 એકમનું છે. વેચાણ કિંમત એકમ દીઠ રૂ. 90 અને ચલિત પડતર એકમ દીઠ રૂ. 40 છે. તો કંપનીની સ્થાયી પડતર શું હશે ?  
 (A) રૂ. 3,00,000 (B) રૂ. 1,20,000  
 (C) રૂ. 2,40,000 (D) રૂ. 3,60,000
299. કંપનીનું કુલ વેચાણ રૂ. 9 લાખ છે અને ઉધાર વેચાણ કુલ વેચાણ ના 60% છે. શરૂઆતના અને આખરના દેવાદારો અનુક્રમે રૂ. 85,000 અને રૂ. 95,000 છે, તો સરેરાશ ઉધરાણી સમય શું હશે ? (વર્ષના 360 દિવસ ધારો)  
 (A) 30 દિવસો (B) 60 દિવસો  
 (C) 45 દિવસો (D) 90 દિવસો

292. Variable cost per unit remains \_\_\_\_\_.  
 (A) Constant (B) Flexible  
 (C) Both A and B (D) None of the above
293. A cost unit is a unit of product or unit of service to which costs are ascertained by means of \_\_\_\_\_.  
 (A) Allocation (B) Apportionment  
 (C) Absorption (D) All of the above
294. A company has Rs. 2,50,000 equity share and its profit after tax is Rs. 10 Lakhs and market price per share is Rs. 50. What will be the price earnings ratio (P/E Ratio) of the company?  
 (A) Rs. 10.00 (B) Rs. 12.50  
 (C) Rs. 25.00 (D) Rs. 15.00
295. Which of the following is not included in cash budget?  
 (A) Prepaid rent (B) income tax paid  
 (C) Goodwill written off (D) Dividend received
296. When the sales increase from Rs. 40,000 to Rs. 60,000 and profit increase by Rs. 5,000 the P/V ratio will be \_\_\_\_\_.  
 (A) 20% (B) 25%  
 (C) 30% (D) 35%
297. In 'make or buy' decision it is profitable to buy from outside only when the supplier's price is below the firm's own \_\_\_\_\_.  
 (A) Total cost (B) sunk cost  
 (C) Fixed cost (D) Variable cost
298. A company's breakeven point is 6,000 units per annum. The selling price is Rs.90 per unit. What will be the company's Fixed Costs?  
 (A) Rs. 3,00,000 (B) Rs. 1,20,000  
 (C) Rs. 2,40,000 (D) Rs. 3,60,000
299. A company has total sales Rs. 9 lakhs and credit sale is 60% of total sales. Its opening and closing debtors are Rs. 85,000 and Rs. 95,000 respectively. What will be the Average Collection Period? (Assume 360 days in a year)  
 (A) 30 days (B) 60 days  
 (C) 45 days (D) 90 days

300. XYZ લી. નીચેની માહિતી આપે છે.

સ્થિર પડતર	રૂ. 5,00,000
ચલિત પડતર	રૂ. 10 એકમ ટીઠ
વેચાણ કિંમત	રૂ. 15 એકમ ટીઠ
વેચાણ	1,50,000 એકમો

સીમાંત હિસાબી રીતનો ઉપયોગ કરીએ તો સમય દરમ્યાન કમાયેલ નફો કેટલો થશે ?

(A) રૂ. 5,00,000

(B) રૂ. 10,00,000

(C) રૂ. 2,50,000

(D) રૂ. 7,50,000

